

Test Date	30/03/2024
Test Time	2:00 PM - 5:00 PM
Subject	215 Planning Assistant UD and UHD
Applicant Photo	
Exam-Day Photo	

Section : Part A - Reasoning, Data Interpretation, Quantitative Aptitude

Q.1 જ્યોતિ (સ્રી)ના પતિના એકમાત્ર પુત્રની બહેનનો જ્યોતિ સાથે શું સંબંધ છે?

Ans ✓ 1. પુત્રી (દીકરી)

✗ 2. માતા

✗ 3. બહેન

✗ 4. ભાઈ

Question ID : 630680653111

Option 1 ID : 6306802556882

Option 2 ID : 6306802556884

Option 3 ID : 6306802556883

Option 4 ID : 6306802556885

Status : Answered

Chosen Option : 2

Q.2 સંખ્યાઓના વર્ગ અને ઘન, જે વાગુ પડતું હોય તેના આધારે, નીચેનામાંથી કઈ જોડી નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે?

169 : 125

Ans ✓ 1. 121 : 27

✗ 2. 125 : 21

✗ 3. 85 : 123

✗ 4. 190 : 281

Question ID : 630680686175

Option 1 ID : 6306802687348

Option 2 ID : 6306802687349


Option 3 ID : 6306802687347

Option 4 ID : 6306802687346

Status : Answered

Chosen Option : 1

Q.3 નીચેનામાંથી કયો વિકલ્પ નીચે આપેલ આકૃતિ (X)માં પ્રશ્ન ચિહ્નનું સ્થાન વેશે?



X.



1.



2.



3.



4.

Ans ✓ 1. 4

✗ 2. 2

✗ 3. 1

✗ 4. 3

Question ID : 630680653120

Option 1 ID : 6306802556921

Option 2 ID : 6306802556919

Option 3 ID : 6306802556918

Option 4 ID : 6306802556920


Status : Answered

Chosen Option : 1

Q.4 નીચેનામાંથી કયા વિકલ્પમાં મૂળ છબી (X) ને જડીત(embed) થશે? (રોટેશનની મંજૂરી નથી)



X.



1.

2.

3.

4.

- Ans
- 1. 4
 - 2. 1
 - 3. 2
 - 4. 3

Question ID : 630680686134

Option 1 ID : 6306802687185

Option 2 ID : 6306802687182

Option 3 ID : 6306802687183

Option 4 ID : 6306802687184

Status : Answered

Chosen Option : 4

Q.5 W નો અર્થ '+', X નો અર્થ '-' Y નો અર્થ 'x' અને Z નો અર્થ \div થાય, તો પછી નીચેની પદાવલીનું મૂલ્ય શું હશે?
 $7Y3W6X4Z2=?$

- Ans
- 1. 23
 - 2. 21
 - 3. 29
 - 4. 25

Question ID : 630680686168

Option 1 ID : 6306802687319

Option 2 ID : 6306802687318

Option 3 ID : 6306802687321

Option 4 ID : 6306802687320

Status : Answered

Chosen Option : 4

Q.6 જ્યાં વાગુ પડતું હોય ત્યાં સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને નીચે આપેલી શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્ન (?) ની જગ્યાએ શું આવશે?
34, 45, 48, 59, 62,??

- Ans
- 1. 73, 76
 - 2. 76, 73
 - 3. 81, 70
 - 4. 70, 81

Question ID : 630680686141

Option 1 ID : 6306802687210

Option 2 ID : 6306802687211

Option 3 ID : 6306802687213

Option 4 ID : 6306802687212

Status : Answered

Chosen Option : 1

Q.7 નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરમાં દર્શાવેલા બે વિધાનોનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ એ નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે કેમ.

પ્રશ્ન: પારુલ, કાજલ, રતિ, સીતા અને તરુણમાં કોણ સૌથી ભારે છે?

વિધાનો:

1. રતિ કાજલ અને તરુણ કરતાં ભારે છે પણ સીતા કરતાં હળવી છે.
2. સીતા સૌથી ભારે નથી.

- Ans**
- ✗ 1. વિધાન 2 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી
 - ✓ 2. વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે
 - ✗ 3. વિધાન 1 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી
 - ✗ 4. વિધાન 1 અથવા વિધાન 2 પર્યાપ્ત છે

Question ID : 630680653147

Option 1 ID : 6306802557027

Option 2 ID : 6306802557028

Option 3 ID : 6306802557026

Option 4 ID : 6306802557029

Status : Answered

Chosen Option : 3

Q.8 નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરમાં દર્શાવેલા બે વિધાનોનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ એ નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે કેમ.

પ્રશ્ન: બાળકોની હરોળમાં કેટલી છોકરીઓ છે?

વિધાનો:

1. પ્રિયા હરોળમાં ડાબી બાજુએથી પંદરમા સ્થાને છે.
2. પ્રિયા હરોળમાં જમણી બાજુથી દસમા સ્થાને છે.

- Ans**
- ✓ 1. વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે
 - ✗ 2. વિધાન 1 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી
 - ✗ 3. વિધાન 2 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી
 - ✗ 4. વિધાન 1 અથવા વિધાન 2 પર્યાપ્ત છે

Question ID : 630680653133

Option 1 ID : 6306802556972

Option 2 ID : 6306802556970

Option 3 ID : 6306802556971

Option 4 ID : 6306802556973

Status : Answered

Chosen Option : 1

Q.9 જ્યાં વાગુ પડતું હોય ત્યાં, સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને નીચે આપેલી શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્ન (?)ની જગ્યાએ શું આવશે?

20, 27, 25, 32, 30,??

- Ans
- ✗ 1. 31, 29
 - ✗ 2. 35, 37
 - ✗ 3. 29, 31
 - ✓ 4. 37, 35

Question ID : 630680653132

Option 1 ID : 6306802556967

Option 2 ID : 6306802556969

Option 3 ID : 6306802556966

Option 4 ID : 6306802556968

Status : Answered

Chosen Option : 4

Q.10 નીચેના કોષ્ટકમાં સાત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપી છે.

The numbers in the brackets give the Maximum marks in Each Subject						
Subject (Max. Marks)						
Student	Maths	Commerce	Physics	GK	History	Computer Science
	(100)	(100)	(100)	(100)	(100)	(100)
Arushi	90	80	90	80	90	84
Aman	100	88	80	90	80	86
Sandy	90	90	90	85	90	80
Ronit	80	85	90	88	80	90
Meenu	90	95	99	95	99	100
Tanu	93	82	85	89	90	80
Tanuj	95	85	90	97	80	89

ઉપરોક્ત કોષ્ટકના આધારે રોનિત દ્વારા તમામ વિષયોમાં એકસાથે ટકાવારીમાં (આશરે) મેળવેલ કુલ ગુણ કેટલા છે?

સંદર્ભ - Subject - વિષય, Max. Mark - મહત્તમ ગુણ, Maths- ગણિત, Commerce - વાણિજ્ય(કોમર્સ), Physic - ભૌતિકશાસ્ત્ર, GK- સામાન્યજ્ઞાન (જીકે), History - ઇતિહાસ, Computer Science - કમ્પ્યુટર સાયન્સ

- Ans
- ✗ 1. 86.5 %
 - ✗ 2. 82.5 %
 - ✗ 3. 83.5 %
 - ✓ 4. 85.5 %

Question ID : 630680686149

Option 1 ID : 6306802687245

Option 2 ID : 6306802687242

Option 3 ID : 6306802687243

Option 4 ID : 6306802687244

Status : Answered

Chosen Option : 4

Q.11 નીચેના કોષ્ટકમાં સાત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છ જુદા જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી આપી છે.

The numbers in the brackets give the Maximum marks in Each Subject						
Subject (Max. Marks)						
Student	Maths	Commerce	Physics	GK	History	Computer Science
	(100)	(100)	(100)	(100)	(100)	(100)
Arushi	90	80	90	80	90	84
Aman	100	88	80	90	80	86
Sandy	90	90	90	85	90	80
Ronit	80	85	90	88	80	90
Meenu	90	95	99	95	99	100
Tanu	93	82	85	89	90	80
Tanuj	95	85	90	97	80	89

ઉપરોક્ત કોષ્ટકના આધારે મીનુએ એકસાથે તમામ વિષયોમાં ટકાવારીમાં (આશરે) મેળવેલા કુલ સરેરાશ ગુણ કેટલા છે? સંદર્ભ - કૌસમાં આપેલા આંકડા દરેક વિષયમાં મહત્તમ ગુણ બતાવે છે

Subject - વિષય, Max. Mark - મહત્તમ ગુણ, Maths- ગણિત, Commerce - વાણિજ્ય(કોમર્સ), Physic -ભૌતિકશાસ્ત્ર, GK- સામાન્યજ્ઞાન (જીકે), History - ઇતિહાસ, Computer Science - કમ્પ્યુટર સાયન્સ, Student- વિદ્યાર્થી, Arushi- આરુષી, Aman- અમન, Sandy-સેન્ડી, Ronit-રોનિત, Meenu-મીનુ, Tanu- તનુ, Tanuj- તનુજ

- Ans
- 1. 93.52 %
 - 2. 92.53 %
 - 3. 96.33 %
 - 4. 98.3 %

Question ID : 630680686179
Option 1 ID : 6306802687363
Option 2 ID : 6306802687362
Option 3 ID : 6306802687364
Option 4 ID : 6306802687365
Status : Answered
Chosen Option : 3

Q.12 જો '\$' નો અર્થ '-', '*' નો અર્થ '+', '@' નો અર્થ '÷', '#' નો અર્થ 'x' થાય, તો નીચેની પદાવલીનું મૂલ્ય શું હશે?

$$22 \# 3 * 35 @ 5 \$ 13 = ?$$

- Ans
- 1. 58
 - 2. 59
 - 3. 60
 - 4. 61

Question ID : 630680686137
Option 1 ID : 6306802687194
Option 2 ID : 6306802687195
Option 3 ID : 6306802687196
Option 4 ID : 6306802687197
Status : Answered
Chosen Option : 3

Q.13 જો P = '+', Q = '-', R = 'x' અને S = '÷' હોય, તો નીચે આપેલ પદાવલીનું મુલ્ય શું હશે?

5 R 8 Q 8 P 12 S 3

- Ans
- ✗ 1. 31
 - ✗ 2. 29
 - ✓ 3. 36
 - ✗ 4. 27

Question ID : 630680653159

Option 1 ID : 6306802557076

Option 2 ID : 6306802557075

Option 3 ID : 6306802557077

Option 4 ID : 6306802557074

Status : Answered

Chosen Option : 3

Q.14 જ્યાં વાયુ પડતું હોય ત્યાં, સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને નીચે આપેલી શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્ન ચિહ્ન (?)ની જગ્યાએ શું આવશે?

16, 20, 18, 22, 20,??

- Ans
- ✓ 1. 24, 22
 - ✗ 2. 23, 25
 - ✗ 3. 25, 23
 - ✗ 4. 22, 24

Question ID : 630680653131

Option 1 ID : 6306802556963

Option 2 ID : 6306802556965

Option 3 ID : 6306802556964

Option 4 ID : 6306802556962

Status : Answered

Chosen Option : 1

Q.15 નીચેના કોષ્ટકમાં સાત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છ જુદા-જુદા વિષયોમાં મેળવેલા ગુણની ટકાવારી દર્શાવી છે.

The numbers in the brackets give the Maximum marks in Each Subject						
Student	Subject (Max. Marks)					
	Maths (100)	Commerce (100)	Physics (100)	GK (100)	History (100)	Computer Science (100)
Arushi	90	80	90	80	90	84
Aman	100	88	80	90	80	86
Sandy	90	90	90	85	90	80
Ronit	80	85	90	88	80	90
Meenu	90	95	99	95	99	100
Tanu	93	82	85	89	90	80
Tanuj	95	85	90	97	80	89

(સંદર્ભ - The numbers in the Brackets give the Maximum Marks in Each Subject - કૌંસમાં આપેલા આંકડા દરેક વિષયમાં મહત્તમ ગુણ બતાવે છે, Subject (Max.Marks)- વિષય (મહત્તમ ગુણ), Max. Mark - મહત્તમ ગુણ, Maths- ગણિત, Commerce - વાણિજ્ય(કોમર્સ), Physic -ભૌતિકશાસ્ત્ર, GK- સામાન્યજ્ઞાન (જીકે), History - ઇતિહાસ, Computer Science - કમ્પ્યુટર સાયન્સ, Student- વિદ્યાર્થી, Arushi- આરુષી, Aman- અમન, Sandy- સેન્ડી, Ronit-રોનિત, Meenu-મીનુ, Tanu-તનુ, Tanuj- તનુજ)

ઉપરોક્ત કોષ્ટકના આધારે અમનના તમામ વિષયોના મળીને કુલ કેટલા ગુણ મેળવ્યા છે?

- Ans**
- ✓ 1. 524
- ✗ 2. 538
- ✗ 3. 556
- ✗ 4. 514

Question ID : 630680653170

Option 1 ID : 6306802557119

Option 2 ID : 6306802557120

Option 3 ID : 6306802557121





Option 4 ID : 6306802557118

Status : Answered

Chosen Option : 1

Q.16 ભારતીય રાજ્ય અને તેના શહેરોના આધારે નીચેનામાંથી કઈ વેન આકૃતિ(Venn diagrams) ઉત્તર પ્રદેશ, લખનઉ અને કાનપુર વચ્ચે શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે?

Ans

- ✗ 1. 
- ✗ 2. 
- ✓ 3. 
- ✗ 4. 

Question ID : 630680686155

Option 1 ID : 6306802687269

Option 2 ID : 6306802687267

Option 3 ID : 6306802687268

Option 4 ID : 6306802687266

Status : Answered

Chosen Option : 3

Q.17 જ્યારે અરીસાને XY રેખા પર મૂકવામાં આવે ત્યારે જવાબી આકૃતિના નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ પ્રશ્ન આકૃતિનું પ્રતિબિંબ(mirror image) હશે?

Question figure:

081318

x // y

(1) 81૧૧૮0 (2) 81૧૧80

(3) 081818 (4) 081318

Ans 1. 3

2. 2

3. 1

4. 4

Question ID : 630680686165

Option 1 ID : 6306802687308

Option 2 ID : 6306802687307

Option 3 ID : 6306802687306

Option 4 ID : 6306802687309

Status : Answered

Chosen Option : 2

Q.18 નીતા મીનુ કરતા ઉંમરમાં મોટી છે. મીનુ ઓજસ જેટલી મોટી નથી. ઉમંગ ઓજસ કરતાં ઉંમરમાં મોટો છે પણ નીતા જેટલો મોટો નથી,તો તેમનામાંથી સૌથી મોટું કોણ છે?

Ans 1. ઓજસ

2. ઉમંગ

3. નીતા

4. મીનુ

Question ID : 630680653119

Option 1 ID : 6306802556914

Option 2 ID : 6306802556916

Option 3 ID : 6306802556917

Option 4 ID : 6306802556915

Status : Answered

Chosen Option : 2

Q.19 જો S નો અર્થ (x), T નો અર્થ (-), U નો અર્થ (\div) અને V નો અર્થ (+) થાય છે, તો નીચેની પદાવલીનું મૂલ્ય શું હશે?

$$(168 \text{ U } 2) \text{ V } (16 \text{ S } 4) = ?$$

- Ans
- 1. 142
 - 2. 124
 - 3. 148
 - 4. 184

Question ID : 630680686139

Option 1 ID : 6306802687203

Option 2 ID : 6306802687202

Option 3 ID : 6306802687204

Option 4 ID : 6306802687205

Status : Answered

Chosen Option : 3

Q.20 એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને સુનંદા (સ્રી) કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતી મહિલા મારી નાનીની એકમાત્ર પુત્રીની એકમાત્ર પુત્રી છે. તો તસ્વીરમાં દેખાતી મહિલા સાથે સુનંદાનો શું સંબંધ છે?

- Ans
- 1. માતા
 - 2. સુનંદા પોતે
 - 3. દાદી
 - 4. નાની

Question ID : 630680653142

Option 1 ID : 6306802557009

Option 2 ID : 6306802557008

Option 3 ID : 6306802557006





Option 4 ID : 6306802557007

Status : Answered

Chosen Option : 2

Q.21 નીચેનામાંથી કઈ વેન આકૃતિ (Venn diagrams) પ્રવાસીઓ, ટ્રેન અને બસ વચ્ચેની શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે?

Ans

- ✗ 1. 
- ✗ 2. 
- ✗ 3. 
- ✓ 4. 

Question ID : 630680653113

Option 1 ID : 6306802556891

Option 2 ID : 6306802556892

Option 3 ID : 6306802556893

Option 4 ID : 6306802556890

Status : Answered

Chosen Option : 4

Q.22 સરિતા રાશીથી મોટી છે. ગીતા રાશી કરતા નાની છે જ્યારે પ્રિયા સરિતા કરતા મોટી છે. તેમનામાંથી સૌથી મોટું કોણ છે?

Ans

- ✗ 1. ગીતા
- ✓ 2. પ્રિયા
- ✗ 3. સરિતા
- ✗ 4. રાશી

Question ID : 630680686129

Option 1 ID : 6306802687165

Option 2 ID : 6306802687163


Option 3 ID : 6306802687162

Option 4 ID : 6306802687164

Status : Answered

Chosen Option : 3

Q.23 નીચેના વિકલ્પોમાં આપેલી આકૃતિઓમાંથી, એવી આકૃતિને પસંદ કરો કે જેમાં પ્રશ્ન આકૃતિ (X) છુપાયેલી/જડેલી (embed) હોય.



(X). 1. 2. 3. 4.

- Ans
- 1. 1
 - 2. 3
 - 3. 4
 - 4. 2

Question ID : 630680653122
Option 1 ID : 6306802556926
Option 2 ID : 6306802556928
Option 3 ID : 6306802556929
Option 4 ID : 6306802556927
Status : Answered
Chosen Option : 4

Q.24 નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ જોડી ફક્ત સંખ્યાઓના સરવાળાના આધારે નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે?

987 : 24

- Ans
- 1. 458 : 18
 - 2. 198 : 15
 - 3. 340 : 60
 - 4. 289 : 19

Question ID : 630680653136
Option 1 ID : 6306802556985
Option 2 ID : 6306802556982
Option 3 ID : 6306802556984
Option 4 ID : 6306802556983
Status : Answered
Chosen Option : 4


Q.25 નીચેનામાંથી કઈ જોડી માત્ર સંખ્યાના સરવાળાના આધારે નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે?

7898 : 32

- Ans
- 1. 2877 : 24
 - 2. 1198 : 17
 - 3. 4258 : 20
 - 4. 3410 : 10

Question ID : 630680686177
Option 1 ID : 6306802687355
Option 2 ID : 6306802687354
Option 3 ID : 6306802687357
Option 4 ID : 6306802687356
Status : Answered
Chosen Option : 1

Q.26 જ્યારે અરીસાને MN પર રાખવામાં આવે, તો વિકલ્પોમાં આપેલી આકૃતિઓમાંથી કઈ આકૃતિ પ્રશ્ન આકૃતિનું સાચું પ્રતિબિંબ હશે?



- Ans
- ✗ 1. MALAYALAM
 - ✗ 2. MAGAYAGAM
 - ✗ 3. MALAYALAM
 - ✓ 4. MAJAYAJAM

Question ID : 630680653185

Option 1 ID : 6306802557181

Option 2 ID : 6306802557179

Option 3 ID : 6306802557180

Option 4 ID : 6306802557178

Status : Answered

Chosen Option : 4

Q.27 નીચેના પ્રશ્નમાં 'પ્રશ્ન' અને તેની નીચે આપેલા 1 અને 2 નંબરમાં દર્શાવેલા બે વિધાનોનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ એ નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે કે કેમ.

પ્રશ્ન: એક સાંકેતિક ભાષામાં 'sand'નો અર્થ(કોડ) શું છે?

વિધાનો:

1. સાંકેતિક ભાષામાં, 'sand is cold'ને 're sa ga' તરીકે લખવામાં આવે છે.

2. એ જ સાંકેતિક ભાષામાં 'mace it cold'ને 're ja no' તરીકે લખવામાં આવે છે.

- Ans
- ✗ 1. વિધાન 1 અથવા વિધાન 2 પર્યાપ્ત છે
 - ✗ 2. વિધાન 2 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 1 એકલું પર્યાપ્ત નથી
 - ✓ 3. ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે.
 - ✗ 4. વિધાન 1 એકલું પર્યાપ્ત છે જ્યારે વિધાન 2 એકલું પર્યાપ્ત નથી

Question ID : 630680653146

Option 1 ID : 6306802557024

Option 2 ID : 6306802557023

Option 3 ID : 6306802557025

Option 4 ID : 6306802557022

Status : Answered

Chosen Option : 3

Q.28 માત્ર અવિભાજ્ય સંખ્યાઓ અને તેમના ક્રમના આધારે નીચેનામાંથી કઈ જોડી નીચે આપેલી પ્રસ્તુતિને સમાન છે?
61 : 89

- Ans**
- 1. 86 : 110
 - 2. 59 : 64
 - 3. 31 : 83
 - 4. 86 : 88

Question ID : 630680686178

Option 1 ID : 6306802687361

Option 2 ID : 6306802687359

Option 3 ID : 6306802687358

Option 4 ID : 6306802687360

Status : Answered

Chosen Option : 3

Q.29 આપેલ વિધાન(ઓ) અને તારણો કાળજીપૂર્વક વાંચો. ધારી વઈએ કે વિધાનોમાં આપવામા આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતોથી ભિન્ન હોય તેવું વાગતું હોય, તો નક્કી કરો કે વિધાન(ઓ)માંથી આપેલા તારણો પૈકી કયું તારણ તાર્કિક રીતે અનુસરે છે.

વિધાનો:

કેટવાક દહલિયા ફૂલો હોય છે.

કેટવાક ફૂલો કમળ હોય છે.

તારણો:

1. બધા દહલિયા (dahlia) કમળ હોય છે.

2. બધા કમળ દહલિયા (dahlia) હોય છે.

- Ans**
- 1. માત્ર તારણ 2 અનુસરે છે
 - 2. ન તો તારણ 1 કે ન તો તારણ 2 અનુસરે છે
 - 3. બંને તારણ 1 અને 2 અનુસરે છે
 - 4. માત્ર તારણ 1 અનુસરે છે

Question ID : 630680653115

Option 1 ID : 6306802556899

Option 2 ID : 6306802556900

Option 3 ID : 6306802556901

Option 4 ID : 6306802556898

Status : Answered

Chosen Option : 4

Q.30 નીચેનામાંથી કયો વિકલ્પ નીચે આપેલી આકૃતિમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને આવશે? (રોટેશનની મંજૂરી નથી)



X.



1.



2.



3.



4.

Ans ✓ 1. 3

✗ 2. 2

✗ 3. 4

✗ 4. 1

Question ID : 630680686162

Option 1 ID : 6306802687296

Option 2 ID : 6306802687295

Option 3 ID : 6306802687297

Option 4 ID : 6306802687294

Status : Answered

Chosen Option : 1

Q.31 જો $a = 10$, $b = 14$, અને $c = 16$, તો $a^2 + b^2 + c^2 + 2(ab + bc + ca)$ નું મૂલ્ય શોધો.

Ans ✗ 1. 1400

✓ 2. 1600

✗ 3. 2500

✗ 4. 900

Question ID : 630680686214

Option 1 ID : 6306802687499

Option 2 ID : 6306802687500

Option 3 ID : 6306802687501

Option 4 ID : 6306802687498

Status : Answered

Chosen Option : 2

Q.32 6 અવલોકનોનો મધ્યક 25 હોય, અને જ્યારે દરેક અવલોકનમાં અચળ 'C' ઉમેરવામાં આવે, તો મધ્યક 31 થાય છે. તો Cનું મૂલ્ય _____ છે.

Ans ✗ 1. 3

✓ 2. 6

✗ 3. 2

✗ 4. 12

Question ID : 630680653232

Option 1 ID : 6306802557367

Option 2 ID : 6306802557368

Option 3 ID : 6306802557366

Option 4 ID : 6306802557369

Status : Answered

Chosen Option : 2

Q.33 એક વ્યક્તિ સ્થિર પાણીમાં 14 km/hr ની ઝડપે પાણીમાં તરી શકે છે. જો પ્રવાહની ઝડપ 8 km/hr હોય, તો વ્યક્તિને 154 km પ્રવાહની દિશામાં જવા માટે કેટલો સમય લાગશે?

- Ans**
- 1. 9 hrs.
 - 2. 6 hrs.
 - 3. 7 hrs.
 - 4. 12 hrs.

Question ID : 630680653223
Option 1 ID : 6306802557332
Option 2 ID : 6306802557330
Option 3 ID : 6306802557331
Option 4 ID : 6306802557333
Status : Answered
Chosen Option : 3

Q.34 એક વસ્તુને ₹ 1620માં વેચવાથી મળતા નફાની ટકાવારી અને તે વસ્તુને ₹ 1200માં વેચવાથી થતા નુકસાનની ટકાવારી સમાન છે. 20% નફો મેળવવા માટે તે વસ્તુને કઈ કિંમતે વેચવી જોઈએ?

- Ans**
- 1. ₹ 1692
 - 2. ₹ 1060
 - 3. ₹ 1542
 - 4. ₹ 1120

Question ID : 630680653242
Option 1 ID : 6306802557406
Option 2 ID : 6306802557409
Option 3 ID : 6306802557408
Option 4 ID : 6306802557407
Status : Answered
Chosen Option : 1

Q.35 ₹660 પર 30%નું સિંગલ ડિસ્કાઉન્ટ અને સમાન રકમ પર ક્રમિક 20% અને 10%ના બે ડિસ્કાઉન્ટ વચ્ચેનો તફાવત કેટલો છે.

- Ans**
- 1. ₹15.2
 - 2. ₹13.2
 - 3. ₹10.5
 - 4. ₹11.6

Question ID : 630680686233
Option 1 ID : 6306802687574
Option 2 ID : 6306802687577
Option 3 ID : 6306802687576
Option 4 ID : 6306802687575
Status : Answered
Chosen Option : 2

Q.36 જો બે રાશિઓનો સરવાળો તેમના તફાવતના પાંચ ગણા બરાબર હોય, તો બે રાશિઓનો ગુણોત્તર _____ છે.

- Ans
- ✗ 1. 2:3
 - ✗ 2. 5:6
 - ✓ 3. 3:2
 - ✗ 4. 6:5

Question ID : 630680653217
Option 1 ID : 6306802557306
Option 2 ID : 6306802557308
Option 3 ID : 6306802557307
Option 4 ID : 6306802557309
Status : Answered
Chosen Option : 1

Q.37 110 થી 150 ની વચ્ચેની તમામ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શોધો.

- Ans
- ✗ 1. 153.57
 - ✗ 2. 143.87
 - ✗ 3. 157.45
 - ✓ 4. 132.67

Question ID : 630680653201
Option 1 ID : 6306802557243
Option 2 ID : 6306802557244
Option 3 ID : 6306802557242
Option 4 ID : 6306802557245
Status : Answered
Chosen Option : 2

Q.38 જો એક બોટ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 54 kmનું અંતર 6 કલાકમાં કાપે છે અને પાછા આવતી વખતે તે જ અંતર 3 કલાકમાં કાપે છે, તો સ્થિર પાણીમાં તે બોટની ઝડપ કેટલી હશે તે શોધો.

- Ans
- ✗ 1. 11.5 km/hr.
 - ✓ 2. 13.5 km/hr.
 - ✗ 3. 9.5 km/hr.
 - ✗ 4. 12.5 km/hr.

Question ID : 630680686212
Option 1 ID : 6306802687491
Option 2 ID : 6306802687493
Option 3 ID : 6306802687490
Option 4 ID : 6306802687492
Status : Answered
Chosen Option : 2

Q.39 નીચે આપેલ પ્રશ્નનો ઉકેલ શોધો.

$$\frac{(480 + 240)^2 - (480 - 240)^2}{(480 \times 240)}$$

- Ans
- 1. 720
 - 2. 240
 - 3. 4
 - 4. 480

Question ID : 630680653285

Option 1 ID : 6306802557581

Option 2 ID : 6306802557579

Option 3 ID : 6306802557578

Option 4 ID : 6306802557580

Status : Answered

Chosen Option : 3

Q.40 મોનિકા તેની કોલેજ જવા માટે 40 km/h ની ઝડપે બાઇક ચલાવે છે. અને 30 km/h ની ઝડપે ઘરે પછી ફરે છે. જો તેની કોલેજ 60 km દૂર છે, તો મોનિકાની જવા-આવવા (round trip) માટેની સરેરાશ ઝડપ કેટલી છે?

- Ans
- 1. 34.3 km/hr.
 - 2. 38.6 km/hr.
 - 3. 40.5 km/hr.
 - 4. 30.5 km/hr.

Question ID : 630680686211

Option 1 ID : 6306802687487

Option 2 ID : 6306802687488

Option 3 ID : 6306802687489

Option 4 ID : 6306802687486

Status : Answered

Chosen Option : 1

Q.41 સોનમ Rs. 4000 ની ખરીદી પર આપવામાં આવતા 30% ડિસ્કાઉન્ટ અથવા 25% અને 5%ના બે ક્રમિક ડિસ્કાઉન્ટ વચ્ચે નિર્ણય કરી શકી ન હતી. બંને ડિસ્કાઉન્ટ વચ્ચે શું તફાવત છે?

- Ans
- ✗ 1. Rs. 25
 - ✗ 2. Rs. 80
 - ✓ 3. Rs. 50
 - ✗ 4. Rs. 75

Question ID : 630680653244
Option 1 ID : 6306802557414
Option 2 ID : 6306802557417
Option 3 ID : 6306802557415
Option 4 ID : 6306802557416
Status : Answered
Chosen Option : 2

Q.42 નીચેના વિકલ્પોમાંથી સૌથી મોટી સંખ્યા શોધો.

- Ans
- ✗ 1. $\frac{8}{12}$
 - ✗ 2. 0.4^2
 - ✗ 3. 0.67
 - ✓ 4. $\frac{5}{6}$

Question ID : 630680686223
Option 1 ID : 6306802687536
Option 2 ID : 6306802687537
Option 3 ID : 6306802687534
Option 4 ID : 6306802687535
Status : Answered
Chosen Option : 4

Q.43 95 લિટરના મિશ્રણમાં, દૂધ અને પાણીનો ગુણોત્તર 3 : 2 છે. જો આ ગુણોત્તર 1 : 2 હોય, તો વધુ કેટલા લિટર પાણી ઉમેરવાનું છે.

- Ans
- ✓ 1. 76 લિટર
 - ✗ 2. 70 લિટર
 - ✗ 3. 60 લિટર
 - ✗ 4. 45 લિટર

Question ID : 630680686236
Option 1 ID : 6306802687589
Option 2 ID : 6306802687586
Option 3 ID : 6306802687588
Option 4 ID : 6306802687587
Status : Answered
Chosen Option : 1

Q.44 એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 60 છે. જો અંશમાં 2 ઉમેરવામાં આવે અને છેદમાંથી 2 બાદ કરવામાં આવે, તો તે $\frac{2}{3}$ બને છે. અપૂર્ણાંક શોધો.

Ans ✓ 1. $\frac{22}{38}$

✗ 2. $\frac{20}{40}$

✗ 3. $\frac{40}{20}$

✗ 4. $\frac{38}{22}$

Question ID : 630680653237

Option 1 ID : 6306802557387

Option 2 ID : 6306802557388

Option 3 ID : 6306802557389

Option 4 ID : 6306802557386

Status : Answered

Chosen Option : 1

Q.45 બે સ્ટેશનો વચ્ચેનું અંતર 240 kms છે. આ અંતર કાપવામાં એક ટ્રેનને 6 કલાક લાગે છે. ટ્રેનની ઝડપની ગણતરી કરો.

Ans ✗ 1. 52 km/hr.

✓ 2. 40 km/hr.

✗ 3. 70 km/hr.

✗ 4. 64 km/hr.

Question ID : 630680653221

Option 1 ID : 6306802557323

Option 2 ID : 6306802557322

Option 3 ID : 6306802557325

Option 4 ID : 6306802557324

Status : Answered

Chosen Option : 2

Q.46 P અને Qની સરેરાશ માસિક આવક ₹ 5010 છે. Q અને Rની સરેરાશ માસિક આવક ₹ 6620 છે અને P અને Rની સરેરાશ માસિક આવક ₹ 5300 છે. Pની માસિક આવક કેટલી છે?

Ans ✗ 1. ₹ 2800

✓ 2. ₹ 3690

✗ 3. ₹ 4485

✗ 4. ₹ 3360

Question ID : 630680686191

Option 1 ID : 6306802687406

Option 2 ID : 6306802687409

Option 3 ID : 6306802687408

Option 4 ID : 6306802687407

Status : Answered

Chosen Option : 2

Q.47 12, 9, 6, ..., સમાંતર શ્રેણીનું 30મું પદ કયું છે?

- Ans 1. -75
 2. -30
 3. -45
 4. -60

Question ID : 630680686218
Option 1 ID : 6306802687514
Option 2 ID : 6306802687517
Option 3 ID : 6306802687516
Option 4 ID : 6306802687515
Status : Answered
Chosen Option : 1

Q.48 ત્રણ સંખ્યાઓ A, B અને C છે. જો Aમાં 5 ઘટાડવામાં આવે અને Bમાં 5 વધારવામાં આવે તો તેમના મૂલ્યો સમાન થશે. જો Cમાં 8 વધારવામાં આવે અને Bમાં 8 વધારવામાં આવે તો તેમના મૂલ્યો સમાન થશે. જો A અને C નો સરવાળો 420 હોય, તો Bનું મૂલ્ય શોધો.

- Ans 1. 350
 2. 280
 3. 205
 4. 215

Question ID : 630680653240
Option 1 ID : 6306802557400
Option 2 ID : 6306802557398
Option 3 ID : 6306802557401
Option 4 ID : 6306802557399
Status : Answered
Chosen Option : 4

Q.49 એક કુંડ સામાન્ય રીતે 14 ક્વાકમાં ભરાય છે પરંતુ તેના તળિયામાં વીકેજ થવાને કારણે તેને ભરવામાં બે ક્વાક વધુ સમય લાગે છે. જો કુંડ ભરવો હોય, તો વીકેજ તેને કેટલા ક્વાકમાં ખાલી કરશે.

- Ans 1. 82 ક્વાક
 2. 110 ક્વાક
 3. 90 ક્વાક
 4. 112 ક્વાક

Question ID : 630680686237
Option 1 ID : 6306802687592
Option 2 ID : 6306802687593
Option 3 ID : 6306802687591
Option 4 ID : 6306802687590
Status : Answered
Chosen Option : 4

Q.50 જો સંખ્યાઓ $n - 5$, $4n - 3$, $5n + 2$ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય, તો n નું મૂલ્ય શું છે?

- Ans
- 1. 3
 - 2. 2
 - 3. $\frac{2}{3}$
 - 4. $\frac{3}{2}$

Question ID : 630680686248

Option 1 ID : 6306802687636

Option 2 ID : 6306802687634

Option 3 ID : 6306802687637

Option 4 ID : 6306802687635

Status : Answered

Chosen Option : 4

Q.51 કોઈ બે સંખ્યાઓના HCF અને LCM 27 અને 192 છે અને સંખ્યાઓ 1 : 9 ના ગુણોત્તરમાં છે. બે સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા શોધો.

- Ans
- 1. 576
 - 2. 128
 - 3. 216
 - 4. 192

Question ID : 630680686224

Option 1 ID : 6306802687541

Option 2 ID : 6306802687538

Option 3 ID : 6306802687540

Option 4 ID : 6306802687539

Status : Answered

Chosen Option : 1

Q.52 P અને Q એક કાર્ય 5 દિવસમાં કરી શકે છે. Q અને R એ જ કાર્ય 8 દિવસમાં કરી શકે છે, જ્યારે R અને P તે જ કાર્ય 10 દિવસમાં કરી શકે છે. જો P, Q અને R એકસાથે મળીને કાર્ય કરે, તો કેટલા દિવસમાં કાર્ય પૂરું થશે?

- Ans
- 1. 40/34
 - 2. 17/40
 - 3. 34/17
 - 4. 80/17

Question ID : 630680686208

Option 1 ID : 6306802687477

Option 2 ID : 6306802687475

Option 3 ID : 6306802687476

Option 4 ID : 6306802687474

Status : Answered

Chosen Option : 4

Q.53 169 મેળવવા માટે એક સંખ્યાને તેના ચોથા ભાગથી ગુણાકાર કરવામાં આવે છે. તે સંખ્યા કઈ છે તે શોધો.

Ans ✓ 1. 26

✗ 2. 28

✗ 3. 22

✗ 4. 24

Question ID : 630680653265

Option 1 ID : 6306802557500

Option 2 ID : 6306802557501

Option 3 ID : 6306802557498

Option 4 ID : 6306802557499

Status : Answered

Chosen Option : 1

Q.54 લંબાઈ = $8a^2b$ અને પહોળાઈ = $3ab^2$ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે?

Ans ✗ 1. $32a^2b^2$

✓ 2. $24a^3b^3$

✗ 3. $12a^3b^3$

✗ 4. $24a^2b^3$

Question ID : 630680686245

Option 1 ID : 6306802687624

Option 2 ID : 6306802687623

Option 3 ID : 6306802687622

Option 4 ID : 6306802687625

Status : Answered

Chosen Option : 2

Q.55 જ્યારે એક સંખ્યામાંથી 48 બાદ કરવામાં આવે છે ત્યારે તે તેના 80% સુધી ઘટે છે. તે સંખ્યાનો ચાર-પંચમાંશ ભાગ શોધો.

Ans ✓ 1. 192

✗ 2. 380

✗ 3. 350

✗ 4. 240

Question ID : 630680653239

Option 1 ID : 6306802557397

Option 2 ID : 6306802557395

Option 3 ID : 6306802557394

Option 4 ID : 6306802557396

Status : Not Answered

Chosen Option : --

Q.56 એક પુસ્તક વિકેતાએ 20% નુકસાનમાં એક પુસ્તક વેચ્યું. જો તેણે તેને ₹114 વધુમાં વેચ્યું હોત, તો તેણે 30% નફો મેળવ્યો હોત, તો પુસ્તકની પડતર કિંમત શીઘો?

Ans ✗ 1. ₹ 234

✗ 2. ₹ 246

✗ 3. ₹ 216

✓ 4. ₹ 228

Question ID : 630680653213

Option 1 ID : 6306802557292

Option 2 ID : 6306802557293

Option 3 ID : 6306802557290

Option 4 ID : 6306802557291

Status : Answered

Chosen Option : 4

Q.57 જો આશ્રિત સુરેખ સમીકરણોની જોડીનું એક સમીકરણ $-4x + 3y - 2 = 0$ હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ બીજું સમીકરણ હોઈ શકે?

Ans ✗ 1. $-4x + 6y - 4 = 0$

✗ 2. $8x + 3y - 2 = 0$

✗ 3. $4x + 3y - 2 = 0$

✓ 4. $-8x + 6y - 4 = 0$

Question ID : 630680653228

Option 1 ID : 6306802557350

Option 2 ID : 6306802557351

Option 3 ID : 6306802557353

Option 4 ID : 6306802557352

Status : Not Answered

Chosen Option : --

Q.58 બે વિદ્યાર્થીઓએ એક પરીક્ષા આપી હતી. તેમાંથી એક વિદ્યાર્થીએ બીજા કરતા 8 ગુણ વધુ મેળવ્યા હતા અને તેના ગુણ તેમના ગુણોના સરવાળાના 55% જેટલા હતા. તેમના દ્વારા મેળવેલા ગુણ _____ છે.

Ans ✓ 1. 36,44

✗ 2. 20,39

✗ 3. 30,42

✗ 4. 28,35

Question ID : 630680653271

Option 1 ID : 6306802557525

Option 2 ID : 6306802557522

Option 3 ID : 6306802557523

Option 4 ID : 6306802557524

Status : Answered

Chosen Option : 1

Q.59 બે સંખ્યાઓનો ન્યૂનતમ સામાન્ય અવયવી 196 છે અને તેનો ગુરુત્તમ સામાન્ય અવયવી 14 છે. જો સંખ્યાઓ વચ્ચેનો તફાવત 60 છે, તો તે સંખ્યાઓના સરવાળાનો વર્ગ કેટલો છે?

- Ans
- 1. 15348
 - 2. 14576
 - 3. 12680
 - 4. 13247

Question ID : 630680653267
Option 1 ID : 6306802557509
Option 2 ID : 6306802557508
Option 3 ID : 6306802557506
Option 4 ID : 6306802557507
Status : Not Answered
Chosen Option : --

Q.60 કોઈ બે સંખ્યાઓ ગુણોત્તર 4 : 7 માં છે. જો તેમની વચ્ચેનો તફાવત 63 હોય, તો નાની સંખ્યા કઈ છે?

- Ans
- 1. 160
 - 2. 59
 - 3. 84
 - 4. 76

Question ID : 630680653277
Option 1 ID : 6306802557549
Option 2 ID : 6306802557547
Option 3 ID : 6306802557548
Option 4 ID : 6306802557546
Status : Answered
Chosen Option : 3

Section : Part B - Constitution of India, Current Affairs, Comprehension, Technical Qualification

Q.61 31 જાન્યુઆરી 2024 સુધીની ઉપલબ્ધ માહિતીના આધારે, નીચેનામાંથી કોણ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ નથી?

- Ans
- 1. લોકસભાના ચૂંટાયેલા સભ્યો
 - 2. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
 - 3. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
 - 4. રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો

Question ID : 630680653083
Option 1 ID : 6306802556782
Option 2 ID : 6306802556785
Option 3 ID : 6306802556783
Option 4 ID : 6306802556784
Status : Answered
Chosen Option : 2

Q.62 ભારતીય બંધારણની નીચેનામાંથી કઈ કલમમા "રાષ્ટ્રપતિની ચૂંટણી" વિશેની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

- Ans 1. કલમ 51
 2. કલમ 52
 3. કલમ 53
 4. કલમ 54

Question ID : 630680653075
Option 1 ID : 6306802556750
Option 2 ID : 6306802556751
Option 3 ID : 6306802556752
Option 4 ID : 6306802556753
Status : Answered
Chosen Option : 4

Q.63 નીચેનામાંથી કયા વર્ષમા ભારતીય બંધારણના ભાગ-IV(A)માં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો?

- Ans 1. 1970
 2. 1981
 3. 1972
 4. 1976

Question ID : 630680653063
Option 1 ID : 6306802556703
Option 2 ID : 6306802556702
Option 3 ID : 6306802556704
Option 4 ID : 6306802556705
Status : Answered
Chosen Option : 2

Q.64 ભારતીય બંધારણના નીચેનામાંથી કઈ કલમમાં "બંધારણીય ઉપાયોનો અધિકાર" સંબંધિત જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

- Ans 1. કલમ - 28
 2. કલમ - 32
 3. કલમ - 14
 4. કલમ - 29

Question ID : 630680686834
Option 1 ID : 6306802689993
Option 2 ID : 6306802689994
Option 3 ID : 6306802689991
Option 4 ID : 6306802689992
Status : Answered
Chosen Option : 2

Q.65 "જાહેર રોજગારની બાબતોમાં તકની સમાનતા", ભારતીય બંધારણના નીચેનામાંથી કઈ કલમનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

- Ans 1. કલમ - 16
 2. કલમ - 15
 3. કલમ - 14
 4. કલમ - 19

Question ID : 630680653070
Option 1 ID : 6306802556732
Option 2 ID : 6306802556731
Option 3 ID : 6306802556730
Option 4 ID : 6306802556733
Status : Answered
Chosen Option : 1

Q.66 15 ફેબ્રુઆરી 2024 સુધીની ઉપલબ્ધ માહિતી મુજબ, નીચેનામાંથી કઈ ભારતની બંધારણીય સંસ્થા છે?

- Ans 1. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
 2. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન
 3. ભારતનું ચૂંટણી પંચ
 4. લોકપાલ અને લોકાયુક્ત

Question ID : 630680686839
Option 1 ID : 6306802690012
Option 2 ID : 6306802690011
Option 3 ID : 6306802690013
Option 4 ID : 6306802690014
Status : Answered
Chosen Option : 3

Q.67 રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સત્તાઓની ચર્ચા ભારતીય બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે?

- Ans 1. ભાગ IV
 2. ભાગ V
 3. ભાગ VI
 4. ભાગ VII

Question ID : 630680653074
Option 1 ID : 6306802556746
Option 2 ID : 6306802556747
Option 3 ID : 6306802556748
Option 4 ID : 6306802556749
Status : Answered
Chosen Option : 2

Q.68 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 દ્વારા નીચેનામાંથી કયો શબ્દ ભારતીય બંધારણના કાયદામાં ઉમેરવામાં આવ્યો હતો?

- Ans
- 1. લોકશાહી (Democratic)
 - 2. સ્વાતંત્ર્યતા (Liberty)
 - 3. પ્રજાસત્તાક (Republic)
 - 4. સમાજવાદી (Socialist)

Question ID : 630680653059
Option 1 ID : 6306802556688
Option 2 ID : 6306802556686
Option 3 ID : 6306802556689
Option 4 ID : 6306802556687
Status : Answered
Chosen Option : 4

Q.69 31 જાન્યુઆરી - 2024 સુધીની ઉપલબ્ધ માહિતી મુજબ, નીચેનામાંથી કઈ ભારતની બંધારણીય સંસ્થા નથી?

- Ans
- 1. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ
 - 2. અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગ
 - 3. નીતિ આયોગ
 - 4. અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગ

Question ID : 630680653076
Option 1 ID : 6306802556755
Option 2 ID : 6306802556757
Option 3 ID : 6306802556754
Option 4 ID : 6306802556756
Status : Answered
Chosen Option : 3

Q.70 31 જાન્યુઆરી, 2024 સુધીની ઉપલબ્ધ માહિતીના આધારે, નીચેનામાંથી કઈ બાબતો/જોગવાઈઓનો ભારતીય બંધારણના કાયદામાં ઉલ્લેખ નથી?

- Ans
- 1. સ્વાતંત્ર્યતા (Liberty)
 - 2. સમાનતા (Equality)
 - 3. રોજગાર (Employment)
 - 4. ન્યાય (Justice)

Question ID : 630680653068
Option 1 ID : 6306802556723
Option 2 ID : 6306802556724
Option 3 ID : 6306802556725
Option 4 ID : 6306802556722
Status : Answered
Chosen Option : 3

Q.71 ભારતના વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાંથી જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM JANMAN)ને મંજૂરી આપી છે?

- Ans
- 1. મધ્યપ્રદેશ
 - 2. નાગાલેન્ડ
 - 3. ઝારખંડ
 - 4. મણિપુર

Question ID : 630680686076
Option 1 ID : 6306802686964
Option 2 ID : 6306802686962
Option 3 ID : 6306802686965
Option 4 ID : 6306802686963
Status : Answered
Chosen Option : 3

Q.72 23 ઓગસ્ટ, 2023નાં રોજ, ભારતે દક્ષિણ ધ્રુવ (South pole) વિસ્તારમાં ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ સાથે ઇતિહાસ રચ્યો. ચંદ્રયાન-3 _____ નાં રોજ GSLV માર્ક 3 (LVM 3) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

- Ans
- 1. 30 જૂન, 2023
 - 2. 14 ઓગસ્ટ, 2023
 - 3. 1 જુલાઈ, 2023
 - 4. 14 જુલાઈ, 2023

Question ID : 630680686084
Option 1 ID : 6306802686994
Option 2 ID : 6306802686995
Option 3 ID : 6306802686996
Option 4 ID : 6306802686997
Status : Answered
Chosen Option : 4

Q.73 વર્ષ 2023માં, ભારતના વડા પ્રધાને વિશ્વ પર્યાવરણ દિવસ પર "MISHTI" યોજના શરૂ કરી છે, MISHTI માં "S" નો અર્થ શું છે?

- Ans
- 1. સી કોસ્ટ (Sea coast)
 - 2. સોઇલ (Soil)
 - 3. શેરોલાઇન (Shoreline)
 - 4. સેફ્ટી (Safety)

Question ID : 630680686090
Option 1 ID : 6306802687020
Option 2 ID : 6306802687018
Option 3 ID : 6306802687021
Option 4 ID : 6306802687019
Status : Answered
Chosen Option : 3

Q.74 નીચેનામાંથી કયા દેશે 2023માં યોજાયેલી 19મી એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીત્યા છે?

- Ans
- 1. ભારત
 - 2. ચીન
 - 3. રિપબ્લિક ઓફ કોરિયા
 - 4. જાપાન

Question ID : 630680686082
Option 1 ID : 6306802686986
Option 2 ID : 6306802686988
Option 3 ID : 6306802686989
Option 4 ID : 6306802686987
Status : Answered
Chosen Option : 2

Q.75 જાન્યુઆરી - 2024માં, નીચેનામાંથી કયા દેશે ગ્રીન ફ્યુઅલ એલાયન્સ ઇન્ડિયા (GFAI) લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે ટકાઉ ઉર્જા સમાધાન ક્ષેત્રે ભારત સાથે સહયોગને આગળ વધારવાના હેતુથી વ્યૂહાત્મક પહેલ છે?

- Ans
- 1. સ્પેન
 - 2. આઇસલેન્ડ
 - 3. નેધરલેન્ડ
 - 4. ડેનમાર્ક

Question ID : 630680653016
Option 1 ID : 6306802556529
Option 2 ID : 6306802556528
Option 3 ID : 6306802556527
Option 4 ID : 6306802556526
Status : Answered
Chosen Option : 3

Q.76 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય SC, ST, OBC, લઘુમતી સમુદાયો અને BPL પરિવારોની 10 થી 18 વર્ષની વયની કન્યાઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રહેણાંક સુવિધાઓ બંને પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી પ્રાથમિકથી માધ્યમિક અને _____ સુધી કન્યાઓનું સરળ પરગમન(transition) સુનિશ્ચિત થાય.

- Ans
- 1. ધોરણ XII
 - 2. ધોરણ X
 - 3. ધોરણ XI
 - 4. ધોરણ VIII

Question ID : 630680653024
Option 1 ID : 6306802556558
Option 2 ID : 6306802556560
Option 3 ID : 6306802556559
Option 4 ID : 6306802556561
Status : Answered
Chosen Option : 1

Q.77 વર્ષ-2023માં ગોવામાં આયોજિત 37મી નેશનલ ગેમ્સમાં નીચેનામાંથી કયા રાજ્યે સૌથી વધુ બ્રોન્ઝ મેડલ જીત્યા છે?

- Ans 1. તમિલનાડુ
 2. પંજાબ
 3. મહારાષ્ટ્ર
 4. હરિયાણા

Question ID : 630680686073
Option 1 ID : 6306802686953
Option 2 ID : 6306802686952
Option 3 ID : 6306802686951
Option 4 ID : 6306802686950
Status : Answered
Chosen Option : 3

Q.78 સપ્ટેમ્બર - 2023માં, નીચેનામાંથી કયા દેશમાં 18મી G20 સમિટ સફળતાપૂર્વક યોજાઈ હતી?

- Ans 1. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા
 2. જાપાન
 3. ભારત
 4. ફ્રાન્સ

Question ID : 630680653018
Option 1 ID : 6306802556537
Option 2 ID : 6306802556535
Option 3 ID : 6306802556534
Option 4 ID : 6306802556536
Status : Answered
Chosen Option : 3

Q.79 પન્ડાલા કિલ્લો ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે?

- Ans 1. મણિપુર
 2. મહારાષ્ટ્ર
 3. જમ્મુ અને કાશ્મીર
 4. મધ્યપ્રદેશ

Question ID : 630680653022
Option 1 ID : 6306802556550
Option 2 ID : 6306802556551
Option 3 ID : 6306802556552
Option 4 ID : 6306802556553
Status : Answered
Chosen Option : 2

Q.80 31 જાન્યુઆરી 2024ના રોજ ઉપલબ્ધ માહિતી મુજબ, નીચેનામાંથી કોણ ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ છે?

Ans ✓ 1. શ્રી જગદીપ ધનખર (Shri Jagdeep Dhankhar)

✗ 2. શ્રી અરુણ ગોયલ

✗ 3. શ્રી ઓમ બિરલા

✗ 4. શ્રી અનૂપ ધર (Shri Anup Dhar)

Question ID : 630680686088

Option 1 ID : 6306802687013

Option 2 ID : 6306802687011

Option 3 ID : 6306802687010

Option 4 ID : 6306802687012

Status : Answered

Chosen Option : 1

Comprehension:

હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજા બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજા ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા તેમણે અમ બે ભાઈઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હંમેશાં પઢી જવાનો નિયમ કર્યો. રામરક્ષા શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

SubQuestion No : 81

Q.81 ફકરાને યોગ્ય શીર્ષક આપો

Ans ✗ 1. ભક્તિ

✗ 2. ભય અને ધર્મ

✓ 3. પાઠ અભિમાન

✗ 4. યાદશક્તિ

Question ID : 630680653103

Option 1 ID : 6306802556852

Option 2 ID : 6306802556851

Option 3 ID : 6306802556850

Option 4 ID : 6306802556853

Status : Answered

Chosen Option : 3

Comprehension:

હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજા બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજા ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા તેમણે અમ બે ભાઈઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હંમેશાં પઢી જવાનો નિયમ કર્યો. રામરક્ષા શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

SubQuestion No : 82**Q.82 શુદ્ધ શબ્દનો વિરુદ્ધાર્થી શોધો**

- Ans 1. પરિશુદ્ધ
 2. અશુદ્ધ
 3. વિશુદ્ધ
 4. સંશુદ્ધ

Question ID : 630680653106

Option 1 ID : 6306802556862

Option 2 ID : 6306802556863

Option 3 ID : 6306802556865

Option 4 ID : 6306802556864

Status : Answered

Chosen Option : 2

Comprehension:

હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજા બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજા ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા તેમણે અમ બે ભાઈઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હંમેશાં પઢી જવાનો નિયમ કર્યો. રામરક્ષા શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

SubQuestion No : 83**Q.83 શ્રદ્ધા શબ્દનો સમાનાર્થી શોધો**

- Ans 1. વૃદ્ધા
 2. આસ્થા
 3. અંધશ્રદ્ધા
 4. બહુમાન

Question ID : 630680653107

Option 1 ID : 6306802556868

Option 2 ID : 6306802556866

Option 3 ID : 6306802556867

Option 4 ID : 6306802556869

Status : Answered

Chosen Option : 2

Comprehension:

હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજા બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજા ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા તેમણે અમ બે ભાઈઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હંમેશાં પઢી જવાનો નિયમ કર્યો. રામરક્ષા શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

SubQuestion No : 84**Q.84 પરિચ્છેદમાં વ્યક્ત તથ્યોનું મૂલ્યાંકન કરો**

- Ans
- 1. ધર્મમહિમા
 - 2. ધર્મધ્યાન
 - 3. પાઠના ઉચ્ચારો
 - 4. રામનામ અમોઘ શક્તિ છે

Question ID : 630680653105

Option 1 ID : 6306802556859

Option 2 ID : 6306802556861

Option 3 ID : 6306802556858

Option 4 ID : 6306802556860

Status : Answered

Chosen Option : 4

Comprehension:

હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજા બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજા ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા તેમણે અમ બે ભાઈઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હંમેશાં પઢી જવાનો નિયમ કર્યો. રામરક્ષા શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

SubQuestion No : 85**Q.85 ફકરાનો કેન્દ્રીય વિચાર શોધો**

- Ans
- 1. બાળપણનો ધર્મ
 - 2. ભક્તિની શક્તિ
 - 3. ભક્તિ
 - 4. સવારની પૂજા

Question ID : 630680653104

Option 1 ID : 6306802556854

Option 2 ID : 6306802556855

Option 3 ID : 6306802556856

Option 4 ID : 6306802556857

Status : Answered

Chosen Option : 1

Comprehension:

Refer to the below passage and answer the questions

Air pollution is a pressing issue that affects human health and the environment. It is caused by natural and human-made pollutants that enter the air, soil, and water. To address this problem, it is crucial to implement policies that reduce pollution and for individuals to take personal measures to reduce their impact on the environment. Apart from restricting industrial pollution, it is also crucial to encourage every citizen to reduce their daily contaminant emissions. The use of vehicles with low fuel efficiency is one of the primary sources of air pollution. Also, the burning of fossil fuels, the use of various aerosol sprays, and gas-powered household appliances can significantly impact air quality.

It is vital to instate more guidelines for the reduction of personal pollution. For example, the Clean Air Act regulates acceptable emissions from stationary and mobile sources, including vehicles. All new vehicles must comply with the act and not exceed the appointed standard for fuel emissions. Thus, individuals should be encouraged to follow the Clean Air Act when selecting fuel-powered cars. Moreover, individuals should take small measures in their everyday life to ensure good air quality, such as limiting the use of aerosols, opting for electric or hybrid cars, and reasonable use of electricity in one's home. Overall, these small steps will help improve the quality of the air.

Air pollution remains a significant environmental issue that requires policies regulating different sources of contamination. Although there are many acts aimed at reducing dangerous emissions into the atmosphere, including the Clean Power Plan and Clean Air Act, there are still many measures that can be implemented to improve air quality. Thus, the work and pollutant emissions of various factories need to be addressed by the government. Meanwhile, individuals can decrease their impact on the environment by opting for electric vehicles, reducing the overall consumption of fossil fuels and unnecessary electricity use. It is only through a collective effort that we can improve air quality and ensure a healthier environment for generations to come.

SubQuestion No : 86

Q.86 Given below is a word, followed by three sentences that consist of that word. From the given options identify the sentence(s) that best express(es) the meaning of the word.

Comply

- A) You must comply with the law.
- B) The staff were clear that they were not going to comply with his request.
- C) Pupils who fail to comply with the rules will be punished.

- Ans**
- 1. B & C only
 - 2. A, B & C
 - 3. A & B only
 - 4. A & C only

Question ID : 630680653041

Option 1 ID : 6306802556623

Option 2 ID : 6306802556622

Option 3 ID : 6306802556625

Option 4 ID : 6306802556624

Status : Answered

Chosen Option : 2

Comprehension:

Refer to the below passage and answer the questions

Air pollution is a pressing issue that affects human health and the environment. It is caused by natural and human-made pollutants that enter the air, soil, and water. To address this problem, it is crucial to implement policies that reduce pollution and for individuals to take personal measures to reduce their impact on the environment. Apart from restricting industrial pollution, it is also crucial to encourage every citizen to reduce their daily contaminant emissions. The use of vehicles with low fuel efficiency is one of the primary sources of air pollution. Also, the burning of fossil fuels, the use of various aerosol sprays, and gas-powered household appliances can significantly impact air quality.

It is vital to instate more guidelines for the reduction of personal pollution. For example, the Clean Air Act regulates acceptable emissions from stationary and mobile sources, including vehicles. All new vehicles must comply with the act and not exceed the appointed standard for fuel emissions. Thus, individuals should be encouraged to follow the Clean Air Act when selecting fuel-powered cars. Moreover, individuals should take small measures in their everyday life to ensure good air quality, such as limiting the use of aerosols, opting for electric or hybrid cars, and reasonable use of electricity in one's home. Overall, these small steps will help improve the quality of the air.

Air pollution remains a significant environmental issue that requires policies regulating different sources of contamination. Although there are many acts aimed at reducing dangerous emissions into the atmosphere, including the Clean Power Plan and Clean Air Act, there are still many measures that can be implemented to improve air quality. Thus, the work and pollutant emissions of various factories need to be addressed by the government. Meanwhile, individuals can decrease their impact on the environment by opting for electric vehicles, reducing the overall consumption of fossil fuels and unnecessary electricity use. It is only through a collective effort that we can improve air quality and ensure a healthier environment for generations to come.

SubQuestion No : 87

Q.87 Select the most appropriate **ANTONYM** of the below mentioned word from the below options.

Significantly

- Ans** 1. Scarcely
 2. Considerably
 3. Substantially
 4. Completely

Question ID : 630680653043

Option 1 ID : 6306802556631

Option 2 ID : 6306802556633

Option 3 ID : 6306802556630

Option 4 ID : 6306802556632

Status : Answered

Chosen Option : 1

Comprehension:

Refer to the below passage and answer the questions

Air pollution is a pressing issue that affects human health and the environment. It is caused by natural and human-made pollutants that enter the air, soil, and water. To address this problem, it is crucial to implement policies that reduce pollution and for individuals to take personal measures to reduce their impact on the environment. Apart from restricting industrial pollution, it is also crucial to encourage every citizen to reduce their daily contaminant emissions. The use of vehicles with low fuel efficiency is one of the primary sources of air pollution. Also, the burning of fossil fuels, the use of various aerosol sprays, and gas-powered household appliances can significantly impact air quality.

It is vital to instate more guidelines for the reduction of personal pollution. For example, the Clean Air Act regulates acceptable emissions from stationary and mobile sources, including vehicles. All new vehicles must comply with the act and not exceed the appointed standard for fuel emissions. Thus, individuals should be encouraged to follow the Clean Air Act when selecting fuel-powered cars. Moreover, individuals should take small measures in their everyday life to ensure good air quality, such as limiting the use of aerosols, opting for electric or hybrid cars, and reasonable use of electricity in one's home. Overall, these small steps will help improve the quality of the air.

Air pollution remains a significant environmental issue that requires policies regulating different sources of contamination. Although there are many acts aimed at reducing dangerous emissions into the atmosphere, including the Clean Power Plan and Clean Air Act, there are still many measures that can be implemented to improve air quality. Thus, the work and pollutant emissions of various factories need to be addressed by the government. Meanwhile, individuals can decrease their impact on the environment by opting for electric vehicles, reducing the overall consumption of fossil fuels and unnecessary electricity use. It is only through a collective effort that we can improve air quality and ensure a healthier environment for generations to come.

SubQuestion No : 88

Q.88 Select the most appropriate **SYNONYM** of the below mentioned word from the below options.

Reasonable

- Ans** 1. Rational
 2. Misleading
 3. Invalid
 4. Illogical

Question ID : 630680653042

Option 1 ID : 6306802556628

Option 2 ID : 6306802556626

Option 3 ID : 6306802556627

Option 4 ID : 6306802556629

Status : Answered

Chosen Option : 1

Comprehension:

Refer to the below passage and answer the questions

Air pollution is a pressing issue that affects human health and the environment. It is caused by natural and human-made pollutants that enter the air, soil, and water. To address this problem, it is crucial to implement policies that reduce pollution and for individuals to take personal measures to reduce their impact on the environment. Apart from restricting industrial pollution, it is also crucial to encourage every citizen to reduce their daily contaminant emissions. The use of vehicles with low fuel efficiency is one of the primary sources of air pollution. Also, the burning of fossil fuels, the use of various aerosol sprays, and gas-powered household appliances can significantly impact air quality.

It is vital to instate more guidelines for the reduction of personal pollution. For example, the Clean Air Act regulates acceptable emissions from stationary and mobile sources, including vehicles. All new vehicles must comply with the act and not exceed the appointed standard for fuel emissions. Thus, individuals should be encouraged to follow the Clean Air Act when selecting fuel-powered cars. Moreover, individuals should take small measures in their everyday life to ensure good air quality, such as limiting the use of aerosols, opting for electric or hybrid cars, and reasonable use of electricity in one's home. Overall, these small steps will help improve the quality of the air.

Air pollution remains a significant environmental issue that requires policies regulating different sources of contamination. Although there are many acts aimed at reducing dangerous emissions into the atmosphere, including the Clean Power Plan and Clean Air Act, there are still many measures that can be implemented to improve air quality. Thus, the work and pollutant emissions of various factories need to be addressed by the government. Meanwhile, individuals can decrease their impact on the environment by opting for electric vehicles, reducing the overall consumption of fossil fuels and unnecessary electricity use. It is only through a collective effort that we can improve air quality and ensure a healthier environment for generations to come.

SubQuestion No : 89

Q.89 Select the most appropriate meaning of the word below from the below options.

Pressing

- Ans** 1. urgent or needing to be dealt with immediately
2. something that someone tells you to do
3. an accepted principle or instruction that states the way things are or should be done
4. to act according to an order, set of rules, or request

Question ID : 630680653044

Option 1 ID : 6306802556634

Option 2 ID : 6306802556637

Option 3 ID : 6306802556636

Option 4 ID : 6306802556635

Status : Answered

Chosen Option : 3

Comprehension:

Refer to the below passage and answer the questions

Air pollution is a pressing issue that affects human health and the environment. It is caused by natural and human-made pollutants that enter the air, soil, and water. To address this problem, it is crucial to implement policies that reduce pollution and for individuals to take personal measures to reduce their impact on the environment. Apart from restricting industrial pollution, it is also crucial to encourage every citizen to reduce their daily contaminant emissions. The use of vehicles with low fuel efficiency is one of the primary sources of air pollution. Also, the burning of fossil fuels, the use of various aerosol sprays, and gas-powered household appliances can significantly impact air quality.

It is vital to instate more guidelines for the reduction of personal pollution. For example, the Clean Air Act regulates acceptable emissions from stationary and mobile sources, including vehicles. All new vehicles must comply with the act and not exceed the appointed standard for fuel emissions. Thus, individuals should be encouraged to follow the Clean Air Act when selecting fuel-powered cars. Moreover, individuals should take small measures in their everyday life to ensure good air quality, such as limiting the use of aerosols, opting for electric or hybrid cars, and reasonable use of electricity in one's home. Overall, these small steps will help improve the quality of the air.

Air pollution remains a significant environmental issue that requires policies regulating different sources of contamination. Although there are many acts aimed at reducing dangerous emissions into the atmosphere, including the Clean Power Plan and Clean Air Act, there are still many measures that can be implemented to improve air quality. Thus, the work and pollutant emissions of various factories need to be addressed by the government. Meanwhile, individuals can decrease their impact on the environment by opting for electric vehicles, reducing the overall consumption of fossil fuels and unnecessary electricity use. It is only through a collective effort that we can improve air quality and ensure a healthier environment for generations to come.

SubQuestion No : 90

Q.90 Identify the suitable title for the passage.

- Ans
- 1. Electric vehicles & its disadvantages
 - 2. Vehicles and collective efforts of society
 - 3. The Clean Air Act
 - 4. Addressing Air Pollution: Policies and Personal Measures

Question ID : 630680653040
Option 1 ID : 6306802556619
Option 2 ID : 6306802556618
Option 3 ID : 6306802556620
Option 4 ID : 6306802556621
Status : Answered
Chosen Option : 4

Q.91 There are _____ methods of contour surveying.

- Ans
- 1. two
 - 2. six
 - 3. three
 - 4. five

Question ID : 630680686259
Option 1 ID : 6306802687682
Option 2 ID : 6306802687685
Option 3 ID : 6306802687683
Option 4 ID : 6306802687684
Status : Answered
Chosen Option : 4

Q.92 BIM is an acronym for Building Information _____.

- Ans
- 1. Moment
 - 2. Measurement
 - 3. Modelling
 - 4. Measures

Question ID : 630680686277
Option 1 ID : 6306802687757
Option 2 ID : 6306802687755
Option 3 ID : 6306802687754
Option 4 ID : 6306802687756
Status : Answered
Chosen Option : 3

Q.93 Marsh watersheds are also known as _____ watersheds.

- Ans
- 1. forest
 - 2. agriculture
 - 3. wetland
 - 4. desert

Question ID : 630680686284
Option 1 ID : 6306802687785
Option 2 ID : 6306802687782
Option 3 ID : 6306802687784
Option 4 ID : 6306802687783
Status : Answered
Chosen Option : 3

Q.94 _____ relies on historical cost data or industry standards to calculate the overall cost based on the quantity of units required.

- Ans
- 1. Cost indexing
 - 2. Unit cost estimation
 - 3. Quantity take-off
 - 4. Parametric estimation

Question ID : 630680686458
Option 1 ID : 6306802688480
Option 2 ID : 6306802688478
Option 3 ID : 6306802688481
Option 4 ID : 6306802688479
Status : Answered
Chosen Option : 2

Q.95 _____ is the time a vehicle is actually in motion while traversing a given section of a highway.

- Ans
- 1. Operational delay
 - 2. Delay
 - 3. Travel time
 - 4. Running time

Question ID : 630680686446
Option 1 ID : 6306802688432
Option 2 ID : 6306802688433
Option 3 ID : 6306802688430
Option 4 ID : 6306802688431
Status : Answered
Chosen Option : 3

Q.96 Read the following about friction dampers.

A. Friction dampers are a type of specialized structural element that can be installed in buildings to absorb seismic shock.

B. These devices are typically mounted to the walls or ceilings of a structure and are designed to reduce the amount of energy transmitted through a building during an earthquake.

Identify the CORRECT statement/statements.

- Ans
- 1. Only B
 - 2. Only A
 - 3. Neither A nor B
 - 4. Both A and B

Question ID : 630680686439
Option 1 ID : 6306802688403
Option 2 ID : 6306802688402
Option 3 ID : 6306802688405
Option 4 ID : 6306802688404
Status : Answered
Chosen Option : 4

Q.97 The fineness of fly ash is a measure of percentage retained on _____-micron sieve when a sample is sieved through it.

- Ans
- 1. 25
 - 2. 65
 - 3. 85
 - 4. 45

Question ID : 630680686488
Option 1 ID : 6306802688598
Option 2 ID : 6306802688600
Option 3 ID : 6306802688601
Option 4 ID : 6306802688599
Status : Answered
Chosen Option : 1

Q.98 Which of the following is a type of technical provision in detailed specifications?

- Ans
- 1. Saves time
 - 2. Standardized format
 - 3. Details of inspection and test
 - 4. Lengthy process of wording to be avoided

Question ID : 630680686339
Option 1 ID : 6306802688002
Option 2 ID : 6306802688004
Option 3 ID : 6306802688005
Option 4 ID : 6306802688003
Status : Answered
Chosen Option : 3

Q.99 _____ was caused by the deadly strain of avian influenza and was spread due to World War I.

- Ans
- 1. Spanish Flu
 - 2. Covid-19
 - 3. Cholera Pandemic
 - 4. Flu Pandemic

Question ID : 630680686434
Option 1 ID : 6306802688382
Option 2 ID : 6306802688383
Option 3 ID : 6306802688385
Option 4 ID : 6306802688384
Status : Answered
Chosen Option : 1

Q.100 Read the following about environmental clearance.

A. Environmental Clearance is the procedure to get clearance from the government for the installation and modification (amendment) of certain projects.

B. It is mandatory for projects which can cause high environmental Pollution.

Identify the INCORRECT statement/statements.

- Ans
- 1. Neither A nor B
 - 2. Only B
 - 3. Both A and B
 - 4. Only A

Question ID : 630680686305
Option 1 ID : 6306802687869
Option 2 ID : 6306802687867
Option 3 ID : 6306802687868
Option 4 ID : 6306802687866
Status : Answered
Chosen Option : 3

Q.101 The _____ is a short, descriptive text typically at or near the top of the map.

- Ans
- 1. source
 - 2. title
 - 3. scale
 - 4. legend

Question ID : 630680686392
Option 1 ID : 6306802688217
Option 2 ID : 6306802688215
Option 3 ID : 6306802688216
Option 4 ID : 6306802688214
Status : Answered
Chosen Option : 4

Q.102 Read the following about inertia forces in structures.

- A. The generation of inertia forces in a structure is one of the seismic influences that detrimentally affect the structure.
B. When an earthquake causes ground shaking, the base of the building would move but the roof would be at rest.
Identify the INCORRECT statement/statements.

- Ans
- 1. Neither A nor B
 - 2. Only A
 - 3. Both A and B
 - 4. Only B

Question ID : 630680686435
Option 1 ID : 6306802688389
Option 2 ID : 6306802688386
Option 3 ID : 6306802688388
Option 4 ID : 6306802688387
Status : Answered
Chosen Option : 3

Q.103 There is little to virtually no vegetation in _____.

- Ans
- 1. agricultural watershed
 - 2. urban watershed
 - 3. desert watershed
 - 4. mountainous watershed

Question ID : 630680686408
Option 1 ID : 6306802688278
Option 2 ID : 6306802688279
Option 3 ID : 6306802688281
Option 4 ID : 6306802688280
Status : Answered
Chosen Option : 3

Q.104 Read the following about watershed development.

A. In a country like India, where the majority of the population is engaged in livelihoods largely dependent on the natural resource such as agriculture, factors like quality, availability and access to natural resources occupy a crucial role in influencing incomes earned by households.

B. Watershed development approach is based on conservation and appropriate management of watershed's natural resources through holistic development of the watershed.

Identify the INCORRECT statement/statements.

Ans 1. Neither A nor B

2. Both A and B

3. Only A

4. Only B

Question ID : 630680686409

Option 1 ID : 6306802688285

Option 2 ID : 6306802688284

Option 3 ID : 6306802688282

Option 4 ID : 6306802688283

Status : Answered

Chosen Option : 2

Q.105 _____ is designed to show the railway systems in India and is published biennially (in two editions, English and Hindi) with corrections supplied by the Railway Board.

Ans 1. 1:3,500,000/1:2,000,000 Road Map of India

2. 1:3,500,000 Railway Map of India

3. 1:1,000,000 and 1:500,000 State Maps

4. 1:1,000,000 Worlds Aeronautical Charts

Question ID : 630680686269

Option 1 ID : 6306802687723

Option 2 ID : 6306802687722

Option 3 ID : 6306802687724

Option 4 ID : 6306802687725

Status : Answered

Chosen Option : 1

Q.106 Following are some of the benefits to schedule of rates.

A. Ease of estimating variations.

B. More continuity when comparing returned tenders.

C. Tendering works before detailed design is carried out.

Which of the following is/are CORRECT?

Ans 1. A, B and C

2. Only A

3. Both A and C

4. Both A and B

Question ID : 630680686341

Option 1 ID : 6306802688013

Option 2 ID : 6306802688010

Option 3 ID : 6306802688011

Option 4 ID : 6306802688012

Status : Answered

Chosen Option : 3

Q.107 Read the following about the main purposes of a cost plan for building maintenance.

- A. Determine the target cost limit for maintaining programme works.
B. Inform setting the annualised maintenance budgets and available funding constraint.
Identify the INCORRECT statement/statements.

- Ans 1. Only B
 2. Neither A nor B
 3. Only A
 4. Both A and B

Question ID : 630680686359
Option 1 ID : 6306802688083
Option 2 ID : 6306802688085
Option 3 ID : 6306802688082
Option 4 ID : 6306802688084
Status : Answered
Chosen Option : 4

Q.108 The ____ cyclone is also known as the "Arctic hurricane" in the Northern Hemisphere.

- Ans 1. polar
 2. extratropical
 3. meso
 4. tropical

Question ID : 630680686433
Option 1 ID : 6306802688380
Option 2 ID : 6306802688381
Option 3 ID : 6306802688378
Option 4 ID : 6306802688379
Status : Answered
Chosen Option : 1

Q.109 The masonry wall between the columns and beams of a frame structure is known as ____.

- Ans 1. Reinforced masonry
 2. Stabilized Mud block
 3. Un-reinforced masonry
 4. Masonry In-fill

Question ID : 630680686317
Option 1 ID : 6306802687915
Option 2 ID : 6306802687917
Option 3 ID : 6306802687916
Option 4 ID : 6306802687914
Status : Answered
Chosen Option : 3

Q.110 Read the following about DGPS.

A. Differential correction is a technique that greatly increases the accuracy of the collected DGPS data.

B. It involves using a receiver at a known location - the "base station"- and comparing that data with DGPS positions collected from unknown locations with "roving receivers".
Identify the CORRECT statement/statements.

- Ans 1. Only A
 2. Neither A nor B
 3. Both A and B
 4. Only B

Question ID : 630680686384
Option 1 ID : 6306802688182
Option 2 ID : 6306802688185
Option 3 ID : 6306802688184
Option 4 ID : 6306802688183
Status : Answered
Chosen Option : 3

Q.111 GRIHA provides a rating of up to _____ stars for green buildings and dispenses points based on criteria's met by any builder.

- Ans 1. three
 2. four
 3. two
 4. five

Question ID : 630680686307
Option 1 ID : 6306802687876
Option 2 ID : 6306802687875
Option 3 ID : 6306802687877
Option 4 ID : 6306802687874
Status : Answered
Chosen Option : 4

Q.112 The chain is composed of 100 or _____ pieces of galvanized mild steel wire called links, joined together with oval rings and handles at both ends.

- Ans 1. 200
 2. 50
 3. 250
 4. 150

Question ID : 630680686377
Option 1 ID : 6306802688156
Option 2 ID : 6306802688154
Option 3 ID : 6306802688157
Option 4 ID : 6306802688155
Status : Answered
Chosen Option : 4

Q.113 There are _____ levels of coastal flooding.

- Ans 1. five
 2. two
 3. three
 4. four

Question ID : 630680686310
Option 1 ID : 6306802687886
Option 2 ID : 6306802687889
Option 3 ID : 6306802687888
Option 4 ID : 6306802687887
Status : Answered
Chosen Option : 4

Q.114 Which of the following is the first step for the construction of roads?

- Ans 1. Demolition and removal
 2. Preliminary planning
 3. Ground levelling
 4. Application of asphalt

Question ID : 630680686323
Option 1 ID : 6306802687939
Option 2 ID : 6306802687938
Option 3 ID : 6306802687941
Option 4 ID : 6306802687940
Status : Answered
Chosen Option : 2

Q.115 Into how many types can cracking of buildings be classified?

- Ans 1. Three
 2. Five
 3. Two
 4. Four

Question ID : 630680686360
Option 1 ID : 6306802688087
Option 2 ID : 6306802688089
Option 3 ID : 6306802688086
Option 4 ID : 6306802688088
Status : Answered
Chosen Option : 1

Q.116 Read the following about Climate change.

- A. Climate change is a great concern in today's scenario.
B. Greenhouse gases are the major cause of climate change.
Identify the CORRECT statement/statements.

- Ans 1. Neither A nor B
 2. Both A and B
 3. Only B
 4. Only A

Question ID : 630680686295
Option 1 ID : 6306802687829
Option 2 ID : 6306802687828
Option 3 ID : 6306802687827
Option 4 ID : 6306802687826
Status : Answered
Chosen Option : 2

Q.117 The average pace length may be taken as _____.

- Ans 1. 60 cm
 2. 80 cm
 3. 40 cm
 4. 100 cm

Question ID : 630680686256
Option 1 ID : 6306802687671
Option 2 ID : 6306802687672
Option 3 ID : 6306802687670
Option 4 ID : 6306802687673
Status : Answered
Chosen Option : 3

Q.118 Read the following about the effects of land pollution.

- A. Land pollution can harm the human body in a variety of ways.
B. Disposal of hazardous radioactive wastes also contributes to land contamination.
Identify the INCORRECT statement/statements.

- Ans 1. Both A and B
 2. Only B
 3. Only A
 4. Neither A nor B

Question ID : 630680686301
Option 1 ID : 6306802687852
Option 2 ID : 6306802687851
Option 3 ID : 6306802687850
Option 4 ID : 6306802687853
Status : Answered
Chosen Option : 1

Q.119 Which of the following is NOT an advanced surveying instrument?

- Ans 1. Plane table
 2. LDM
 3. GPS
 4. Total station

Question ID : 630680686487
Option 1 ID : 6306802688596
Option 2 ID : 6306802688595
Option 3 ID : 6306802688594
Option 4 ID : 6306802688597
Status : Answered
Chosen Option : 1

Q.120 In high mountains and in areas compiled from unreliable material, hypsometric and aneroid heights to the nearest ____ metres.

- Ans 1. 70
 2. 50
 3. 60
 4. 40

Question ID : 630680686387
Option 1 ID : 6306802688197
Option 2 ID : 6306802688195
Option 3 ID : 6306802688196
Option 4 ID : 6306802688194
Status : Answered
Chosen Option : 1

Q.121 Following are the disadvantages of schedule of rates.

- A. Additional resource required to measure work.
B. Less cost assurance for the client.
C. Difficulty for contractors to plan resources long-term.
Which of the following is/are CORRECT?

- Ans 1. Both A and C
 2. Only A
 3. A, B and C
 4. Both A and B

Question ID : 630680686461
Option 1 ID : 6306802688491
Option 2 ID : 6306802688490
Option 3 ID : 6306802688493
Option 4 ID : 6306802688492
Status : Answered
Chosen Option : 3

Q.122 In high mountains and in areas compiled from unreliable material, clinometric heights should be rounded off to the nearest _____ metres.

- Ans
- 1. 2
 - 2. 4
 - 3. 5
 - 4. 3

Question ID : 630680686267
Option 1 ID : 6306802687717
Option 2 ID : 6306802687715
Option 3 ID : 6306802687714
Option 4 ID : 6306802687716
Status : Answered
Chosen Option : 3

Q.123 Fixed-price contracts are also known as _____.

- Ans
- 1. Lump-sum contracts
 - 2. Cost-plus contracts
 - 3. Unit pricing contracts
 - 4. Time & materials contracts

Question ID : 630680686354
Option 1 ID : 6306802688064
Option 2 ID : 6306802688062
Option 3 ID : 6306802688065
Option 4 ID : 6306802688063
Status : Answered
Chosen Option : 3

Q.124 Read the following about License Plate Studies.

A. This study is done using cameras that captures license plates and tracks the movement of the vehicle based on the license plate.

B. This study is best suited for projects where counting all trips is ideal, such as assessing cut-through traffic.

Identify the INCORRECT statement/statements.

- Ans
- 1. Both A and B
 - 2. Only A
 - 3. Neither A nor B
 - 4. Only B

Question ID : 630680686444
Option 1 ID : 6306802688424
Option 2 ID : 6306802688422
Option 3 ID : 6306802688425
Option 4 ID : 6306802688423
Status : Answered
Chosen Option : 1

Q.125 The ITC Green Centre of _____ is an example of Green Building in India.

- Ans 1. Gurgaon
 2. Kolkata
 3. Madhya Pradesh
 4. Bangalore

Question ID : 630680686426
Option 1 ID : 6306802688350
Option 2 ID : 6306802688352
Option 3 ID : 6306802688351
Option 4 ID : 6306802688353
Status : Answered
Chosen Option : 1

Q.126 The distance in pacing can be obtained by _____ the number of paces with the average length of the pace.

- Ans 1. subtracting
 2. dividing
 3. adding
 4. multiplying

Question ID : 630680686376
Option 1 ID : 6306802688152
Option 2 ID : 6306802688153
Option 3 ID : 6306802688151
Option 4 ID : 6306802688150
Status : Answered
Chosen Option : 2

Q.127 Laminated timber is also known as _____.

- Ans 1. Cork
 2. Bamboo
 3. Cob
 4. Mass timber

Question ID : 630680686369
Option 1 ID : 6306802688125
Option 2 ID : 6306802688122
Option 3 ID : 6306802688124
Option 4 ID : 6306802688123
Status : Answered
Chosen Option : 4

Q.128 Which of the following is NOT the requirement of a good alignment?

- Ans 1. Easy
 2. Economical
 3. Long
 4. Safe

Question ID : 630680686453
Option 1 ID : 6306802688458
Option 2 ID : 6306802688461
Option 3 ID : 6306802688459
Option 4 ID : 6306802688460
Status : Answered
Chosen Option : 1

Q.129 _____ of rainwater harvesting is the surface that receives rainfall directly.

- Ans 1. Gutter
 2. Mesh filter
 3. Catchment
 4. Conduit

Question ID : 630680686287
Option 1 ID : 6306802687795
Option 2 ID : 6306802687796
Option 3 ID : 6306802687794
Option 4 ID : 6306802687797
Status : Answered
Chosen Option : 4

Q.130 Noise becomes harmful when it exceeds 75 decibels (dB) and is painful above _____ dB.

- Ans 1. 120
 2. 140
 3. 80
 4. 100

Question ID : 630680686419
Option 1 ID : 6306802688324
Option 2 ID : 6306802688325
Option 3 ID : 6306802688322
Option 4 ID : 6306802688323
Status : Answered
Chosen Option : 2

Q.131 Read the following about construction equipment management.

A. A construction equipment manager needs to be able to take practical decisions with regards to management of the construction equipment to ensure maximum benefits with minimal expenses for the company.

B. Construction equipment should ideally pay for themselves by helping the owner earn more than it costs to own, operate, maintain, store and use the machine.
Identify the INCORRECT statement/statements.

- Ans
- 1. Only B
 - 2. Both A and B
 - 3. Only A
 - 4. Neither A nor B

Question ID : 630680686475
Option 1 ID : 6306802688547
Option 2 ID : 6306802688548
Option 3 ID : 6306802688546
Option 4 ID : 6306802688549
Status : Answered
Chosen Option : 2

Q.132 Who of the following professionals do not use CAD?

- Ans
- 1. Drafters
 - 2. Product designers
 - 3. School teachers
 - 4. Engineers

Question ID : 630680686398
Option 1 ID : 6306802688239
Option 2 ID : 6306802688241
Option 3 ID : 6306802688238
Option 4 ID : 6306802688240
Status : Answered
Chosen Option : 3

Q.133 _____ reconnaissance provides a comprehensive view of potential alignments, aiding in the identification of factors influencing the rejection or modification of alignments.

- Ans
- 1. Study of sheets
 - 2. Aerial
 - 3. Ground
 - 4. Study of maps

Question ID : 630680686254
Option 1 ID : 6306802687665
Option 2 ID : 6306802687663
Option 3 ID : 6306802687662
Option 4 ID : 6306802687664
Status : Answered
Chosen Option : 1

Q.134 Which of the following is the last stage of tendering process?

- Ans 1. Award of contract
 2. Evaluation of the tender submissions
 3. Advertising the requirement
 4. Invitation to Tender (ITT)

Question ID : 630680686472
Option 1 ID : 6306802688534
Option 2 ID : 6306802688537
Option 3 ID : 6306802688535
Option 4 ID : 6306802688536
Status : Answered
Chosen Option : 1

Q.135 A 3D laser scanner operates much like the reflector less _____ to collect the 3D coordinates (x, y, and z coordinates) of a specific environment entirely with just a single device to produce a high-resolution point cloud.

- Ans 1. tapes
 2. total stations
 3. dumpy levels
 4. theodolites

Question ID : 630680686372
Option 1 ID : 6306802688135
Option 2 ID : 6306802688136
Option 3 ID : 6306802688134
Option 4 ID : 6306802688137
Status : Answered
Chosen Option : 2

Q.136 _____ schedules are commonly used for routine tasks and ongoing responsibilities.

- Ans 1. Timeline
 2. Traditional
 3. Delay
 4. Event

Question ID : 630680686356
Option 1 ID : 6306802688073
Option 2 ID : 6306802688070
Option 3 ID : 6306802688071
Option 4 ID : 6306802688072
Status : Answered
Chosen Option : 4

Q.137 PPE is the short form for _____ Protective Equipment.

- Ans 1. Primary
 2. Personal
 3. Projection
 4. Project

Question ID : 630680686486
Option 1 ID : 6306802688593
Option 2 ID : 6306802688590
Option 3 ID : 6306802688592
Option 4 ID : 6306802688591
Status : Answered
Chosen Option : 1

Q.138 Which of the following is the first stage of tendering process?

- Ans 1. Invitation to Tender (ITT)
 2. Award of contract
 3. Evaluation of the tender submissions
 4. Advertising the requirement

Question ID : 630680686352
Option 1 ID : 6306802688054
Option 2 ID : 6306802688057
Option 3 ID : 6306802688056
Option 4 ID : 6306802688055
Status : Answered
Chosen Option : 1

Q.139 Max permissible values as per IRC for motor vehicle other than transport and not having more than 2 axles is _____.

- Ans 1. 8.5 m
 2. 6.5 m
 3. 7.5 m
 4. 9.5 m

Question ID : 630680686449
Option 1 ID : 6306802688444
Option 2 ID : 6306802688442
Option 3 ID : 6306802688443
Option 4 ID : 6306802688445
Status : Answered
Chosen Option : 3

Q.140 Following are the causes of construction site accidents.

- A. Lack of fall protection for workers on elevated structures.
 - B. Lack of protection for people on the ground from falling objects.
 - C. Tripping hazards from construction materials and debris.
- Which of the following is/are CORRECT?

- Ans
- 1. Both A and C
 - 2. A, B and C
 - 3. Both A and B
 - 4. Only A

Question ID : 630680686365
Option 1 ID : 6306802688107
Option 2 ID : 6306802688109
Option 3 ID : 6306802688108
Option 4 ID : 6306802688106
Status : Answered
Chosen Option : 3

Q.141 _____ rent refers to the price paid for the use of the homogeneous land when its supply is limited in relation to demand.

- Ans
- 1. Economic
 - 2. Differential
 - 3. Scarcity
 - 4. Gross

Question ID : 630680686351
Option 1 ID : 6306802688052
Option 2 ID : 6306802688051
Option 3 ID : 6306802688050
Option 4 ID : 6306802688053
Status : Answered
Chosen Option : 1

Q.142 _____ is one of the most hazardous gases emitted during agricultural activities.

- Ans
- 1. Sulphur Dioxide
 - 2. Methane
 - 3. Nitrogen Oxide
 - 4. Ammonia

Question ID : 630680686418
Option 1 ID : 6306802688319
Option 2 ID : 6306802688318
Option 3 ID : 6306802688321
Option 4 ID : 6306802688320
Status : Answered
Chosen Option : 2

Q.143 Read the following about external reinforcement.

- A. Exterior reinforcement is a common way to reduce the damage caused by an earthquake.
B. This technique involves adding steel or concrete structures to the exterior of buildings to reinforce them and make them more resistant to shaking.
Identify the CORRECT statement/statements.

- Ans 1. Only B
 2. Both A and B
 3. Only A
 4. Neither A nor B

Question ID : 630680686319
Option 1 ID : 6306802687923
Option 2 ID : 6306802687924
Option 3 ID : 6306802687922
Option 4 ID : 6306802687925
Status : Answered
Chosen Option : 2

Q.144 Contour lines with U-shape with convexity towards lower ground indicate _____.

- Ans 1. hills
 2. steep slope
 3. ridge
 4. pond

Question ID : 630680686379
Option 1 ID : 6306802688165
Option 2 ID : 6306802688163
Option 3 ID : 6306802688164
Option 4 ID : 6306802688162
Status : Answered
Chosen Option : 4

Q.145 _____ are those maps that represent the relief and terrain.

- Ans 1. Economic maps
 2. Planimetric maps
 3. Hypsometric maps
 4. Population maps

Question ID : 630680686394
Option 1 ID : 6306802688224
Option 2 ID : 6306802688223
Option 3 ID : 6306802688222
Option 4 ID : 6306802688225
Status : Answered
Chosen Option : 3

Q.146 Read the following about market approach.

A. The market approach means a unique valuation method that allows one to determine the actual value of any asset based on other similar asset types having similar features.

B. One important aspect of the market data approach is the usage of prices of assets rather than the size of assets adjusted for quantities.

Identify the INCORRECT statement/statements.

- Ans
- 1. Both A and B
 - 2. Only B
 - 3. Neither A nor B
 - 4. Only A

Question ID : 630680686344

Option 1 ID : 6306802688024

Option 2 ID : 6306802688023

Option 3 ID : 6306802688025

Option 4 ID : 6306802688022

Status : Answered

Chosen Option : 1

Q.147 Earthquake causes shaking of the ground in all the _____ directions.

- Ans
- 1. four
 - 2. two
 - 3. three
 - 4. five

Question ID : 630680686315

Option 1 ID : 6306802687908

Option 2 ID : 6306802687906

Option 3 ID : 6306802687907

Option 4 ID : 6306802687909

Status : Answered

Chosen Option : 3

Q.148 Which of the following is the last step of road construction?

- Ans
- 1. Final roll
 - 2. Application of asphalt
 - 3. Ground levelling
 - 4. Pouring of binder layer

Question ID : 630680686443

Option 1 ID : 6306802688420

Option 2 ID : 6306802688418

Option 3 ID : 6306802688419

Option 4 ID : 6306802688421

Status : Answered

Chosen Option : 4

Q.149 Following are the sources of water for recharge.

- A. Precipitation (rainfall) over the demarcated area.
 - B. Large roof areas from where rainwater can be collected and diverted for recharge.
 - C. Canals from large reservoirs from which water can be made available for recharge.
- Which of the following is/are CORRECT?

- Ans
- 1. Both B and C
 - 2. Only A
 - 3. Both A and C
 - 4. A, B and C

Question ID : 630680686283
Option 1 ID : 6306802687780
Option 2 ID : 6306802687778
Option 3 ID : 6306802687779
Option 4 ID : 6306802687781
Status : Answered
Chosen Option : 4

Q.150 Read the following about income approach.

- A. The income approach, under the specific context of real estate valuation, is a method used by appraisers to determine a property's market value based on its income.
 - B. The income approach, or "capitalization approach", states that the value of an investment property is a function of the quality and quantity of the income it is expected to generate.
- Identify the INCORRECT statement/statements.

- Ans
- 1. Neither A nor B
 - 2. Only A
 - 3. Only B
 - 4. Both A and B

Question ID : 630680686463
Option 1 ID : 6306802688501
Option 2 ID : 6306802688498
Option 3 ID : 6306802688499
Option 4 ID : 6306802688500
Status : Answered
Chosen Option : 4

Q.151 Read the following about the main purposes of a cost plan for building maintenance.

- A. Provide cost information to assist decision makers to make informed decisions.
 - B. Inform what asset investment are funded or not funded and then revise life cycle cost plan.
- Identify the CORRECT statement/statements.

- Ans
- 1. Only A
 - 2. Only B
 - 3. Both A and B
 - 4. Neither A nor B

Question ID : 630680686479
Option 1 ID : 6306802688562
Option 2 ID : 6306802688563
Option 3 ID : 6306802688564
Option 4 ID : 6306802688565
Status : Answered
Chosen Option : 3

Q.152 The objective of _____ audit is to recognize fraud cases, control and decrease instances of fraud through the application of suggestions and recommendations and internal Audit control in the entity.

- Ans
- 1. external
 - 2. tax
 - 3. forensic
 - 4. statutory

Question ID : 630680686423
Option 1 ID : 6306802688339
Option 2 ID : 6306802688341
Option 3 ID : 6306802688338
Option 4 ID : 6306802688340
Status : Answered
Chosen Option : 2

Q.153 _____ coat is a thin surface treatment used to water-proof the surface and to provide skid resistance.

- Ans
- 1. Surface
 - 2. Seal
 - 3. Prime
 - 4. Tack

Question ID : 630680686332
Option 1 ID : 6306802687977
Option 2 ID : 6306802687974
Option 3 ID : 6306802687975
Option 4 ID : 6306802687976
Status : Answered
Chosen Option : 3

Q.154 Read the following about the significance of environment in human life.

A. Environmental resources, which include both renewable and non-renewable resources, are available for use in the production of goods and services.

B. The environment includes the elements of sunlight, water, air, and soil, all of which are essential for human survival.

Identify the CORRECT statement/statements.

- Ans
- 1. Both A and B
 - 2. Only A
 - 3. Neither A nor B
 - 4. Only B

Question ID : 630680686293
Option 1 ID : 6306802687820
Option 2 ID : 6306802687818
Option 3 ID : 6306802687821
Option 4 ID : 6306802687819
Status : Answered
Chosen Option : 1

Q.155 _____ uses mathematical models and statistical analysis to estimate project costs.

- Ans
- 1. Unit Cost estimation
 - 2. Cost indexing
 - 3. Parametric estimation
 - 4. Quantity Take-off

Question ID : 630680686337
Option 1 ID : 6306802687996
Option 2 ID : 6306802687997
Option 3 ID : 6306802687995
Option 4 ID : 6306802687994
Status : Answered
Chosen Option : 1

Q.156 As a line-of-sight, non-contact device, laser scanners can successfully get hold of 3D measurements with up to _____ accuracy.

- Ans
- 1. 2 mm
 - 2. 1 mm
 - 3. 3 mm
 - 4. 4 mm

Question ID : 630680686491
Option 1 ID : 6306802688611
Option 2 ID : 6306802688610
Option 3 ID : 6306802688612
Option 4 ID : 6306802688613
Status : Answered
Chosen Option : 1

Q.157 The objective of _____ audit is to check whether the Financial Statements prepared by the Management provide an accurate and fair view.

- Ans
- 1. internal
 - 2. external
 - 3. forensic
 - 4. statutory

Question ID : 630680686303
Option 1 ID : 6306802687859
Option 2 ID : 6306802687858
Option 3 ID : 6306802687860
Option 4 ID : 6306802687861
Status : Answered
Chosen Option : 1

Q.158 The full form of NPV is Net Present _____.

- Ans 1. Valuation
 2. Value
 3. Vault
 4. Volt

Question ID : 630680686470
Option 1 ID : 6306802688526
Option 2 ID : 6306802688527
Option 3 ID : 6306802688528
Option 4 ID : 6306802688529
Status : Answered
Chosen Option : 1

Q.159 Read the following about Obligatory points.

- A. Obligatory points are the controlling points that govern the highway alignments.
B. The obligatory points are responsible for the deviation of highway.
Identify the CORRECT statement/statements.

- Ans 1. Neither A nor B
 2. Only A
 3. Only B
 4. Both A and B

Question ID : 630680686454
Option 1 ID : 6306802688465
Option 2 ID : 6306802688462
Option 3 ID : 6306802688463
Option 4 ID : 6306802688464
Status : Answered
Chosen Option : 4

Q.160 In the real estate market, there are _____ physical characteristics of land.

- Ans 1. two
 2. four
 3. five
 4. three

Question ID : 630680686346
Option 1 ID : 6306802688030
Option 2 ID : 6306802688032
Option 3 ID : 6306802688033
Option 4 ID : 6306802688031
Status : Answered
Chosen Option : 2

Q.161 Read the following about the effects of land pollution.

A. Land contamination, such as that caused by mining, farming, and factories, may allow harmful chemicals to enter the soil and water.

B. These chemicals have the potential to kill animals and plants, destroying the food chain. Identify the CORRECT statement/statements.

- Ans
- 1. Neither A nor B
 - 2. Both A and B
 - 3. Only B
 - 4. Only A

Question ID : 630680686421
Option 1 ID : 6306802688333
Option 2 ID : 6306802688332
Option 3 ID : 6306802688331
Option 4 ID : 6306802688330
Status : Answered
Chosen Option : 2

Q.162 A Y-junction has three arms of which all the _____ roads are of equal sizes.

- Ans
- 1. four
 - 2. two
 - 3. three
 - 4. five

Question ID : 630680686455
Option 1 ID : 6306802688468
Option 2 ID : 6306802688466
Option 3 ID : 6306802688467
Option 4 ID : 6306802688469
Status : Answered
Chosen Option : 2

Q.163 Following are the limitations of DGPS.

A. International Limitation of Accuracy
B. Receiver Independent Exchange Format
C. Reference System Co-ordinates
Which of the following is/are CORRECT?

- Ans
- 1. A, B and C
 - 2. Both B and C
 - 3. Both A and C
 - 4. Only A

Question ID : 630680686264
Option 1 ID : 6306802687705
Option 2 ID : 6306802687704
Option 3 ID : 6306802687703
Option 4 ID : 6306802687702
Status : Answered
Chosen Option : 1

Q.164 _____ provides signal of the presence of the user in places and events.

- Ans 1. Ear plugs
 2. Boots
 3. Gloves
 4. Reflective Gear

Question ID : 630680686483
Option 1 ID : 6306802688578
Option 2 ID : 6306802688579
Option 3 ID : 6306802688580
Option 4 ID : 6306802688581
Status : Answered
Chosen Option : 4

Q.165 Which gas is released into the air and influence global cooling due to volcanic eruptions?

- Ans 1. Oxygen
 2. Sulphur Dioxide
 3. Carbon Dioxide
 4. Nitrogen Oxide

Question ID : 630680686296
Option 1 ID : 6306802687830
Option 2 ID : 6306802687833
Option 3 ID : 6306802687832
Option 4 ID : 6306802687831
Status : Answered
Chosen Option : 3

Q.166 There are _____ main methods of interpolation of contours.

- Ans 1. two
 2. four
 3. three
 4. five

Question ID : 630680686261
Option 1 ID : 6306802687690
Option 2 ID : 6306802687692
Option 3 ID : 6306802687691
Option 4 ID : 6306802687693
Status : Answered
Chosen Option : 4

Q.167 A _____ scale is the most common type of scale.

- Ans
- 1. logarithmic
 - 2. linear
 - 3. exponential
 - 4. diagonal

Question ID : 630680686273
Option 1 ID : 6306802687738
Option 2 ID : 6306802687741
Option 3 ID : 6306802687740
Option 4 ID : 6306802687739
Status : Answered
Chosen Option : 2

Q.168 The Asphalt Institute recommends a _____ - to 5-day curing period under good conditions when emulsified bases are being constructed.

- Ans
- 1. 2
 - 2. 4
 - 3. 3
 - 4. 1

Question ID : 630680686331
Option 1 ID : 6306802687971
Option 2 ID : 6306802687973
Option 3 ID : 6306802687972
Option 4 ID : 6306802687970
Status : Answered
Chosen Option : 3

Q.169 Read the following about special considerations in Depreciated Replacement Cost.

A. When calculating the replacement cost of an asset, a company must account for depreciation costs.

B. A business capitalizes an asset purchase by posting the cost of a new asset to an asset account, and the asset account is depreciated over the asset's useful life.

Identify the CORRECT statement/statements.

- Ans
- 1. Both A and B
 - 2. Neither A nor B
 - 3. Only B
 - 4. Only A

Question ID : 630680686469
Option 1 ID : 6306802688524
Option 2 ID : 6306802688525
Option 3 ID : 6306802688523
Option 4 ID : 6306802688522
Status : Answered
Chosen Option : 1

Q.170 Read the following about base isolation.

A. Base Isolation is easiest to incorporate in the design of new construction.
B. This seismic design strategy involves separating the building from the foundation and acts to absorb shock.
Identify the CORRECT statement/statements.

- Ans 1. Neither A nor B
 2. Both A and B
 3. Only B
 4. Only A

Question ID : 630680686429
Option 1 ID : 6306802688365
Option 2 ID : 6306802688364
Option 3 ID : 6306802688363
Option 4 ID : 6306802688362
Status : Answered
Chosen Option : 2

Q.171 _____ experiences perhaps the most dynamically significant land-use change.

- Ans 1. Desert watershed
 2. Agricultural watershed
 3. Mountainous watershed
 4. Urban watershed

Question ID : 630680686404
Option 1 ID : 6306802688265
Option 2 ID : 6306802688262
Option 3 ID : 6306802688264
Option 4 ID : 6306802688263
Status : Answered
Chosen Option : 1

Q.172 The maximum net intensity of loading at the base of the foundation that soil can support before failing in shear is called the _____.

- Ans 1. Ultimate bearing capacity
 2. Bearing capacity
 3. Gross safe bearing capacity
 4. Net safe bearing capacity

Question ID : 630680686400
Option 1 ID : 6306802688246
Option 2 ID : 6306802688247
Option 3 ID : 6306802688249
Option 4 ID : 6306802688248
Status : Answered
Chosen Option : 4

Q.173 The full form of EIA is Environmental ____ Assessment.

- Ans 1. Impact
 2. Improvement
 3. Improving
 4. Introduction

Question ID : 630680686424
Option 1 ID : 6306802688344
Option 2 ID : 6306802688342
Option 3 ID : 6306802688343
Option 4 ID : 6306802688345
Status : Answered
Chosen Option : 1

Q.174 ____ flooding begins within 6 hours of the start of heavy rainfall, and is often caused by severe thunderstorms, hurricanes, tropical storms or other weather patterns.

- Ans 1. Coastal
 2. River
 3. Fluvial
 4. Pluvial

Question ID : 630680686430
Option 1 ID : 6306802688369
Option 2 ID : 6306802688368
Option 3 ID : 6306802688366
Option 4 ID : 6306802688367
Status : Answered
Chosen Option : 1

Q.175 Read the following about cost optimization.

- A. Cost optimization is a process that should be carried out throughout the construction period to ensure that the cost of the project is within an allotted budget.
B. Time and cost are the two most significant factors in any construction project.
Identify the CORRECT statement/statements.

- Ans 1. Only B
 2. Neither A nor B
 3. Only A
 4. Both A and B

Question ID : 630680686358
Option 1 ID : 6306802688079
Option 2 ID : 6306802688081
Option 3 ID : 6306802688078
Option 4 ID : 6306802688080
Status : Answered
Chosen Option : 4

Q.176 A discrete LiDAR system may record _____ returns from each laser pulse.

- Ans
- 1. 1-13+
 - 2. 1-11+
 - 3. 1-12+
 - 4. 1-14+

Question ID : 630680686385
Option 1 ID : 6306802688188
Option 2 ID : 6306802688186
Option 3 ID : 6306802688187
Option 4 ID : 6306802688189
Status : Answered
Chosen Option : 2

Q.177 Read the following about the conservation of rivers.

- A. The conservation of the river ecosystem is non-transferable now.
B. A reasonable legal protection mechanism working hand in hand with the existing statutes must be instituted for the protection of rivers.
Identify the CORRECT statement/statements.

- Ans
- 1. Only A
 - 2. Only B
 - 3. Both A and B
 - 4. Neither A nor B

Question ID : 630680686410
Option 1 ID : 6306802688286
Option 2 ID : 6306802688287
Option 3 ID : 6306802688288
Option 4 ID : 6306802688289
Status : Answered
Chosen Option : 2

Q.178 Closely spaced contour lines indicate _____ slope.

- Ans
- 1. steep
 - 2. uniform
 - 3. gentle
 - 4. equal

Question ID : 630680686378
Option 1 ID : 6306802688159
Option 2 ID : 6306802688161
Option 3 ID : 6306802688158
Option 4 ID : 6306802688160
Status : Answered
Chosen Option : 3

Q.179 A _____ collects the filtered water for future use.

- Ans
- 1. conduit
 - 2. gutter
 - 3. first flush device
 - 4. storage tank

Question ID : 630680686412
Option 1 ID : 6306802688296
Option 2 ID : 6306802688297
Option 3 ID : 6306802688295
Option 4 ID : 6306802688294
Status : Answered
Chosen Option : 1

Q.180 Who of the following do not use the CAD software?

- Ans
- 1. Interior designers
 - 2. Fashion Designers
 - 3. Doctors
 - 4. Architects

Question ID : 630680686278
Option 1 ID : 6306802687758
Option 2 ID : 6306802687761
Option 3 ID : 6306802687760
Option 4 ID : 6306802687759
Status : Answered
Chosen Option : 3

Q.181 Which type of parking can accommodate maximum number of vehicles for a given kerb length?

- Ans
- 1. Sixty degree
 - 2. Parallel
 - 3. Forty five degree
 - 4. Right angle

Question ID : 630680686328
Option 1 ID : 6306802687961
Option 2 ID : 6306802687959
Option 3 ID : 6306802687960
Option 4 ID : 6306802687958
Status : Answered
Chosen Option : 3

Q.182 Read the following about Implementing Green Initiatives to minimize operation costs in buildings.

A. Building owners who adopt environmentally friendly practices often see meaningful savings in operating costs, especially over the long term.

B. Upfront investments in infrastructure like solar panels, green roofs, or more efficient equipment can pay off over a building's life span.

Identify the INCORRECT statement/statements.

- Ans
- 1. Both A and B
 - 2. Only A
 - 3. Neither A nor B
 - 4. Only B

Question ID : 630680686362
Option 1 ID : 6306802688096
Option 2 ID : 6306802688094
Option 3 ID : 6306802688097
Option 4 ID : 6306802688095
Status : Answered
Chosen Option : 1

Q.183 _____ is the time taken by a vehicle to traverse a given section of a highway.

- Ans
- 1. Operational delay
 - 2. Running time
 - 3. Delay
 - 4. Travel time

Question ID : 630680686326
Option 1 ID : 6306802687953
Option 2 ID : 6306802687952
Option 3 ID : 6306802687951
Option 4 ID : 6306802687950
Status : Answered
Chosen Option : 2

Q.184 When the lender assures the borrower that the rate of interest will remain the same throughout the loan period is called _____ Mortgage

- Ans
- 1. Simple
 - 2. Fixed-Rate
 - 3. English
 - 4. Anomalous

Question ID : 630680686468
Option 1 ID : 6306802688520
Option 2 ID : 6306802688518
Option 3 ID : 6306802688519
Option 4 ID : 6306802688521
Status : Answered
Chosen Option : 2

Q.185 In a _____ the water level in a bore will rise to a level higher than the top of the aquifer because of the high pressure.

- Ans
- 1. unconfined aquifer
 - 2. perched aquifer
 - 3. confined aquifer
 - 4. aquitard

Question ID : 630680686402
Option 1 ID : 6306802688254
Option 2 ID : 6306802688257
Option 3 ID : 6306802688256
Option 4 ID : 6306802688255
Status : Answered
Chosen Option : 3

Q.186 _____ fires usually advance far faster than lower level fires.

- Ans
- 1. crown
 - 2. rapid
 - 3. surface
 - 4. ground

Question ID : 630680686432
Option 1 ID : 6306802688374
Option 2 ID : 6306802688377
Option 3 ID : 6306802688376
Option 4 ID : 6306802688375
Status : Answered
Chosen Option : 3

Q.187 _____ is not an example of a producer.

- Ans
- 1. Plants
 - 2. Green algae
 - 3. Parasite
 - 4. Algae

Question ID : 630680686294
Option 1 ID : 6306802687823
Option 2 ID : 6306802687825
Option 3 ID : 6306802687822
Option 4 ID : 6306802687824
Status : Answered
Chosen Option : 2

Q.188 Read the following about optical methods for measurements in surveying.

- A. It is done with a Tacheometer, which works on the principle of optics.
B. The instrument is ideal when the ground is not suitable for surveying (uneven).
Identify the CORRECT statement/statements.

- Ans 1. Neither A nor B
 2. Only A
 3. Both A and B
 4. Only B

Question ID : 630680686257
Option 1 ID : 6306802687677
Option 2 ID : 6306802687674
Option 3 ID : 6306802687676
Option 4 ID : 6306802687675
Status : Answered
Chosen Option : 3

Q.189 The cost approach definition refers to a valuation technique in which an appraiser values a property by _____ construction costs and the land value and then deducting depreciation from the result.

- Ans 1. dividing
 2. subtracting
 3. adding
 4. multiplying

Question ID : 630680686345
Option 1 ID : 6306802688029
Option 2 ID : 6306802688028
Option 3 ID : 6306802688027
Option 4 ID : 6306802688026
Status : Answered
Chosen Option : 3

Q.190 Read the following about the economic aspects of land.

- A. Land is viewed in economic terms as a factor of production.
B. This asset value has many uses, ranging for example, from security for mortgage loans to use as a tax base.
Identify the INCORRECT statement/statements.

- Ans 1. Only B
 2. Only A
 3. Both A and B
 4. Neither A nor B

Question ID : 630680686467
Option 1 ID : 6306802688515
Option 2 ID : 6306802688514
Option 3 ID : 6306802688516
Option 4 ID : 6306802688517
Status : Answered
Chosen Option : 3

Q.191 The representation of town on _____ might be confined to a point symbol such as a geometric figure.

- Ans
- 1. 1:1,00,000
 - 2. 1:1,000
 - 3. 1:10,000
 - 4. 1:1,000,000

Question ID : 630680686388
Option 1 ID : 6306802688200
Option 2 ID : 6306802688198
Option 3 ID : 6306802688199
Option 4 ID : 6306802688201
Status : Answered
Chosen Option : 3

Q.192 Read the following about retrofitting.

A. Retrofitting allows existing structures to be fortified against the forces of an earthquake.
B. It is a cost-effective way to improve the seismic performance of an older building, and it can be completed in just a few weeks with minimal disruption to the occupants.
Identify the INCORRECT statement/statements.

- Ans
- 1. Both A and B
 - 2. Only B
 - 3. Only A
 - 4. Neither A nor B

Question ID : 630680686321
Option 1 ID : 6306802687932
Option 2 ID : 6306802687931
Option 3 ID : 6306802687930
Option 4 ID : 6306802687933
Status : Answered
Chosen Option : 1

Q.193 _____ is the focal point of real estate, which deals with transactions involving land and buildings used for residential, commercial, and agricultural use.

- Ans
- 1. Private property
 - 2. Government-owned property
 - 3. Personal property
 - 4. Real property

Question ID : 630680686462
Option 1 ID : 6306802688496
Option 2 ID : 6306802688497
Option 3 ID : 6306802688495
Option 4 ID : 6306802688494
Status : Answered
Chosen Option : 2

Q.194 Read the following about the uses of CAD.

- A. Computer-aided design is used in a wide variety of professions.
B. CAD software is used heavily within various architecture, arts and engineering projects.
Identify the INCORRECT statement/statements.

- Ans 1. Only A
 2. Both A and B
 3. Neither A nor B
 4. Only B

Question ID : 630680686396
Option 1 ID : 6306802688230
Option 2 ID : 6306802688232
Option 3 ID : 6306802688233
Option 4 ID : 6306802688231
Status : Answered
Chosen Option : 2

Q.195 Read the following about watershed development.

- A. Watershed development refers to the conservation; regeneration and the judicious use of all the natural resources particularly land, water, vegetation and animals and human development within the watershed.
B. Watershed as a unit enables planners and implementing agency to consider all inputs, processes and expected outputs systematically which are essential for a holistic development approach.
Identify the CORRECT statement/statements.

- Ans 1. Only B
 2. Only A
 3. Neither A nor B
 4. Both A and B

Question ID : 630680686285
Option 1 ID : 6306802687787
Option 2 ID : 6306802687786
Option 3 ID : 6306802687789
Option 4 ID : 6306802687788
Status : Answered
Chosen Option : 4

Q.196 _____ ensures that debris that was settled in the gutters before rainfall does not end up in the rainwater harvesting system.

- Ans 1. First flush device
 2. Mesh filter
 3. Catchment
 4. Conduit

Question ID : 630680686411
Option 1 ID : 6306802688293
Option 2 ID : 6306802688290
Option 3 ID : 6306802688292
Option 4 ID : 6306802688291
Status : Answered
Chosen Option : 2

Q.197 A T-junction has _____ arms of which one arm is a main road whereas the other one is usually a minor road connecting the main road.

- Ans
- 1. four
 - 2. two
 - 3. five
 - 4. three

Question ID : 630680686335
Option 1 ID : 6306802687987
Option 2 ID : 6306802687989
Option 3 ID : 6306802687986
Option 4 ID : 6306802687988
Status : Answered
Chosen Option : 2

Q.198 Read the following about map layout.

- A. In a map, the individual components get their meaning only with reference to the map as a whole.
B. Map design involves the development of this integrated plan and style of the map and its individual components, and layout involves the arrangement of these individual components on the map.
Identify the CORRECT statement/statements.

- Ans
- 1. Only A
 - 2. Both A and B
 - 3. Only B
 - 4. Neither A nor B

Question ID : 630680686391
Option 1 ID : 6306802688210
Option 2 ID : 6306802688212
Option 3 ID : 6306802688211
Option 4 ID : 6306802688213
Status : Answered
Chosen Option : 2

Q.199 _____ UAVs are the most affordable and simple to build.

- Ans
- 1. Fixed-wing hybrid
 - 2. Multirotor
 - 3. Single rotor
 - 4. Fixed-wing

Question ID : 630680686382
Option 1 ID : 6306802688177
Option 2 ID : 6306802688174
Option 3 ID : 6306802688176
Option 4 ID : 6306802688175
Status : Answered
Chosen Option : 4

Q.200 Read the following about the square method of measurement of areas.

- A. The square method is the most common method to measure area.
B. In this method, the area to be measured is covered by squares by placing a sheet of graph paper beneath the map on an illuminated tracing table or by tracing the area onto the graph sheet.

Identify the CORRECT statement/statements.

- Ans 1. Only B
 2. Only A
 3. Both A and B
 4. Neither A nor B

Question ID : 630680686275
Option 1 ID : 6306802687747
Option 2 ID : 6306802687746
Option 3 ID : 6306802687748
Option 4 ID : 6306802687749
Status : Answered
Chosen Option : 3

Q.201 Read the following about transition curves.

- A. A transition curve is a horizontal curve having a variable radius i.e., infinity at the tangential point to the selected radius of the horizontal curve.
B. The infinite radius at the tangential point implies that the transition curve is straight at the point where it offsets the straight road.
Identify the CORRECT statement/statements.

- Ans 1. Neither A nor B
 2. Both A and B
 3. Only B
 4. Only A

Question ID : 630680686450
Option 1 ID : 6306802688449
Option 2 ID : 6306802688448
Option 3 ID : 6306802688447
Option 4 ID : 6306802688446
Status : Answered
Chosen Option : 2

Q.202 Which of the following is NOT a benefit of 3D laser scanning?

- Ans 1. Precise Measurements
 2. Increases health hazards
 3. Non-Intrusive Technology
 4. Saves Time and Effort

Question ID : 630680686371
Option 1 ID : 6306802688133
Option 2 ID : 6306802688130
Option 3 ID : 6306802688131
Option 4 ID : 6306802688132
Status : Answered
Chosen Option : 2

Q.203 Read the following about the importance of safety management.

A. It is essential to consider safety measures during construction projects.

B. Safety equipment and tools not only protect labourers but can risk lives as well.

Identify the CORRECT statement/statements.

- Ans
- 1. Only B
 - 2. Only A
 - 3. Neither A nor B
 - 4. Both A and B

Question ID : 630680686364
Option 1 ID : 6306802688103
Option 2 ID : 6306802688102
Option 3 ID : 6306802688105
Option 4 ID : 6306802688104
Status : Answered
Chosen Option : 2

Q.204 _____ released by incomplete combustion of fossil fuels also results in air pollution.

- Ans
- 1. Methane
 - 2. Oxygen
 - 3. Nitrogen Oxide
 - 4. Carbon Monoxide

Question ID : 630680686298
Option 1 ID : 6306802687838
Option 2 ID : 6306802687841
Option 3 ID : 6306802687840
Option 4 ID : 6306802687839
Status : Answered
Chosen Option : 4

Q.205 In the _____ method of soil stabilization, stabilizers are injected into the soil for stabilizing the soil.

- Ans
- 1. mass stabilization
 - 2. deep mixing
 - 3. electrical
 - 4. grouting

Question ID : 630680686401
Option 1 ID : 6306802688251
Option 2 ID : 6306802688253
Option 3 ID : 6306802688252
Option 4 ID : 6306802688250
Status : Answered
Chosen Option : 4

Q.206 Intensity is the amount of damage the earthquake causes locally, which can be characterized by the _____ level Modified Mercalli Scale (MM) where each level designates a certain amount of destruction correlated to ground acceleration.

- Ans 1. 12
 2. 9
 3. 11
 4. 10

Question ID : 630680686308
Option 1 ID : 6306802687881
Option 2 ID : 6306802687878
Option 3 ID : 6306802687880
Option 4 ID : 6306802687879
Status : Answered
Chosen Option : 1

Q.207 The Global Positioning System, formally known as the Navstar Global Positioning System, was initiated as a joint civil/military technical program in _____.

- Ans 1. 1993
 2. 1963
 3. 1973
 4. 1983

Question ID : 630680686263
Option 1 ID : 6306802687701
Option 2 ID : 6306802687698
Option 3 ID : 6306802687699
Option 4 ID : 6306802687700
Status : Answered
Chosen Option : 3

Q.208 The _____ sees the specificity and detail of your schedule increase as the project deadline approaches.

- Ans 1. PERT
 2. Last Planner System
 3. Gantt Chart
 4. Resource Scheduling

Question ID : 630680686476
Option 1 ID : 6306802688550
Option 2 ID : 6306802688551
Option 3 ID : 6306802688552
Option 4 ID : 6306802688553
Status : Answered
Chosen Option : 1

Q.209 _____ speed is the instantaneous speed of a vehicle at a specified location.

- Ans
- 1. Non-uniform
 - 2. Average
 - 3. Spot
 - 4. Uniform

Question ID : 630680686445
Option 1 ID : 6306802688429
Option 2 ID : 6306802688427
Option 3 ID : 6306802688426
Option 4 ID : 6306802688428
Status : Answered
Chosen Option : 3

Q.210 Read the following about effects of earthquakes on buildings.

- A. When a building experiences earthquake and ground shaking occurs, the base of the building moves with the ground shaking.
B. However, the roof movement would be different from that of the base of the structure.
Identify the CORRECT statement/statements.

- Ans
- 1. Only A
 - 2. Neither A nor B
 - 3. Both A and B
 - 4. Only B

Question ID : 630680686318
Option 1 ID : 6306802687918
Option 2 ID : 6306802687921
Option 3 ID : 6306802687920
Option 4 ID : 6306802687919
Status : Answered
Chosen Option : 3